

Super Visa/ Visitor to Canada Insurance



- Best Mortgage Rates
- 1st and 2nd Mortgages
- Life and Critical Illness Insurance
- RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations
GTA East / GTA West
Investment | Insurance | Mortgages

પરદેશમાં દેશની મહેક એટલે



સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH




રાજ્યમાં તૌકતેનું તોફાન : ભરૂનાળે માવઠું

કેનેડામાંથી મોકલેલ સહાયક સાધનોને લઈને ભરૂનાળે પહોંચી ગયેલા સુધારા કાર્યકર્તાઓએ તોફાન પડ્યા પછી સુધારા કાર્ય શરૂ કર્યું છે. દિલ્લી રાજ્યમાંથી મોકલેલ સહાયક સાધનોને લઈને ભરૂનાળે પહોંચી ગયેલા સુધારા કાર્યકર્તાઓએ તોફાન પડ્યા પછી સુધારા કાર્ય શરૂ કર્યું છે.

ગુજરાતમાં વાવાઝોડાથી તારાજી અંગેના સમાચાર વાંચો

PAGE NO. 18-19

FRIDAY, 21 MAY, 2021 Vol. 18, No. 21 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના વધતા કેસને પગલે સારવાર સુવિધા ઊભી કરવા ક્વાયત 5 રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસ મહામારી જાહેર

નવી દિલ્હી

દેશના સંખ્યાબંધ રાજ્યમાં બ્લેક ફંગસના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકારે ગુરુવારે બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ)ને એપિમિક ડિસીઝ એક્ટ ૧૯૮૭ અંતર્ગત મહામારી જાહેર કરવા સૂચના આપી છે. આ પછી ગુજરાતમાં પણ મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. આ અગાઉ રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણા, હરિયાણામાં મહામારી જાહેર કરી દેવાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિણય કરાયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનિંગ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આસીએમઆર દ્વારા આ રોગ માટે નક્કી કરાયેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની તમામ વિગતો કેન્દ્ર સરકારને મોકલવાની રહેશે. મહામારી જાહેર કરવાને કારણે હવે આ રોગની સારવાર માટેના ઈન્જેક્શનોના કાળાબજાર કુરનારા સામે પણ કડક કાર્યવાહી કરી શકાશે. ઉપરાંત ડોક્ટરને પણ મ્યુકોરના દર્દીઓને સારવાર કરવાની ફરજ પાડી શકશે. અગાઉ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, બ્લેક ફંગસનું ઈન્જેક્શન કોરોનાના દર્દીઓમાં મૃત્યુદર અને ગંભીર માંદગી વધારી રહ્યું છે. રાજ્યને લખેલા પત્રમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં મ્યુકોરમાઈકોસિસ નામની ફૂગના સંક્રમણનો પડકાર ઊભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ આરોગ્ય મંત્રાલય, આઈસીએમઆર દ્વારા મ્યુકોરમાઈકોસિસ, સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ અને સારવારની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ મ્યુકોરમાઈકોસિસના તમામ શંકાસ્પદ અને કન્ફર્મ કેસની જાણ જિલ્લા સ્તરના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય વિભાગ અને આઈસીએમઆર સર્વેલન્સ સિસ્ટમને કરવાની રહેશે. હાલ સિવિલ હોસ્પિટલોમાં આ રોગની સારવાર શરૂ કરાઈ છે.



પટણામાં વ્હાઈટ ફંગસના 4 કેસ

ભારત પર એક પછી એક આફતો આવી રહી છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ સંખ્યાબંધ રાજ્યોમાં બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ)ના કેસ હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે હવે બિહારની રાજધાની પટણામાં વ્હાઈટ ફંગસના ચાર કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કેન્ડિડોસિસ નામની ફૂગ કોરોનાના ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ પર મોટું જોખમ છે. વ્હાઈટ ફંગસ ફેફસાં, ચામડી, નખ, મોં, આંતરડાં, કિડની, ગુમાંગ અને મગજને સંક્રમિત કરી શકે છે.

ઇન્જેક્શનની માહિતી આપવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ : બ્લેક ફંગસના દર્દીઓના ઘલાજ માટે વપરાતા એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની અછતના અહેવાલો વચ્ચે દિલ્હી હાઇકોર્ટ ગુરુવારે કેન્દ્ર સરકાર પાસે એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની સ્થિતિ અંગે તમામ માહિતીની માગ કરી હતી. જે બાદ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, દવાનું ઉત્પાદન કરતી તમામ કંપનીઓને એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનનું ઉત્પાદન બંધાવવાનું સૂચના આપી દેવાઇ છે.

રાજ્યો પર બ્લેક ફંગસનો ઓછાચો

રાજસ્થાન : ૪૦૦ સંક્રમિતોએ બ્લેક ફંગસના કારણે દૈનિક ગુમાવી, જયપુરમાં ૧૪૮, બોધપુરમાં ૧૦૦, બિકાનેરમાં ૩૦ કેસ
મધ્યપ્રદેશ : ૫૮૫ દર્દી બ્લેક ફંગસથી સંક્રમિત, ભોપાલમાં ૨૩૮માંથી ૧૦ દર્દીનાં મોત, ૧૨૮ની સર્જરી કરાઈ
છત્તીસગઢ : ૧૦૦થી વધુ કેસ, ૮૨નો હોસ્પિ.માં ઘલાજ, ૧૯ દર્દીની સર્જરી કરાઈ
હરિયાણા : ૧૧૭ મ્યુકોરમાઈકોસિસના કેસ, સ્ટિરોઇડના વેચાણ પર રાજ્યમાં પ્રતિબંધ મુકાયો
દિલ્હી : બ્લેક ફંગસના કેસ ૩૦૦ને પાર, એમ્સમાં ૮૦ દર્દીમાંથી ૩૦ની સ્થિતિ ગંભીર
મહારાષ્ટ્ર : ૨૫૦૦થી વધુ કેસ, ૮૦નાં મોત, ૫૦૦ દર્દી સ્ટિવર, ૮૫૦ સારવાર હેઠળ
આંધ્રપ્રદેશ : બ્લેક ફંગસના ૨૦૦થી વધુ કેસ, ગુંતુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ૫૦ સારવાર હેઠળ છે.

એન્ટાર્કટિકા ઉપર દિલ્હીથી પણ ૩ ગણો મોટો ગ્લેશિયર તૂટ્યો



વોશિંગ્ટન

ક્લાઈમેટ ચેન્જની અસર બરફના ગઢ ગણાતા એન્ટાર્કટિકા પર પણ ઝડપથી થઈ રહી છે, એન્ટાર્કટિકામાં દિલ્હીથી ત્રણ ગણા કદનો, વિશ્વનો સૌથી મોટો હિમખંડ તૂટીને અલગ થયો છે. આ હિમખંડ ૧૭૦ કિલોમીટર લાંબો છે અને ૨૫ કિલોમીટર પહોળો છે અને તેનું સંપૂર્ણ કદ ૪,૩૨૦ સ્ક્વેર કિલોમીટરનું છે. એન્ટાર્કટિકામાં પશ્ચિમ હિસ્સામાં આવેલ રોસ્સે આઈસ શેલ્ફમાંથી આ મહાકાય હિમખંડ અલગ થયો છે. યુરોપીય સ્પેસ એજન્સીના સેટેલાઈટ કોપરનિકસ સેન્ટિનલમાંથી લેવામાં આવેલી તસવીરોમાં મહાકાય હિમખંડ અલગ પડી રહ્યો હોવાનું જણાયું છે. આ સેટેલાઈટ ખાસ પૃથ્વીના ધ્રુવીય વિસ્તારો પર નજર રાખે છે. એન્ટાર્કટિકામાં આ ઘટના બનવાથી વિશ્વભરના વેજાનિકોમાં ચિંતાનું વાતાવરણ છે. આ હિમખંડ તૂટ્યા બાદ હવે તે વેડેલ સમુદ્રમાં છૂટો તરી રહ્યો છે. વિશ્વના આ સૌથી મોટા હિમખંડને એ-૭૬ એવું નામ આપવામાં આવ્યું છે. બરફ ઓગળી જાય તો સમુદ્રનું સ્તર ૨૦૦ ફૂટ સુધી વધી શકે નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટર અનુસાર આ હિમખંડ તૂટવાથી તરત જ સમુદ્રના જળસ્તર પર કોઈ અસર નહીં થાય, જો કે પરોક્ષ રીતે જળસ્તર વધી શકે છે.

લેબનોને ઈઝરાયેલ ઉપર રોકેડ છોડતા મુશ્કેલી વધી

PAGE NO. 15

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપનો અમે ખૂબજ આભાર માનીએ છીએ. ફ્લાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

કોરોનાની ગતિ મંદ, નવા 3888 કેસ, 38ના મોત

14 દિવસમાં સરેરાશ કેસની સંખ્યામાં 2000નો ઘટાડો, સંક્રમણમાં ઓન્ટેરિયો ફરી 2400 કેસ સાથે આગળ રહ્યું

ઓન્ટેરિયો
કેનેડામાં કોરોના વાયરસની બીજી લહેરમાં ગતિ હવે ધીમે ધીમે મંદ પડી રહી છે. ગુરુવારે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના 3888 કેસ નોંધાયા સાથે 38 દર્દીના મોત નિપજયા હતા. જો કે, દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હજી પણ 61293 હોવાથી સરકાર અને તંત્ર સમગ્ર સ્થિતિને ગંભીરતાથી લઈને કામગીરી કરી રહ્યા છે. હાલમાં દેશમાં 1344 દર્દીઓની હાલત અત્યંત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.

કેનેડામાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ગત 7 મેના રોજ કોરોનાના 5766 કેસ નોંધાયા પછી એક અઠવાડિયામાં સ્થિતિ સુધરી હતી અને 14મી મેના રોજ કોરોનાના દર્દીની સંખ્યા 4498 નોંધાઈ હતી. જ્યારે તેના

અઠવાડિયા પછી 21મીએ કોરોનાના કેસનો ગ્રાફ વધુ નીચે ઉતરીને 3888 કેસ થયો હતો.

ગુરુવારે સૌથી વધુ ઓન્ટેરિયોમાં 2400 દર્દી મળ્યા હતા. જ્યારે અહીં 27 દર્દીના મોત થયા હતા. આ ઉપરાંત ક્યુબેકમાં નવા 662 કેસ મળવા સાથે 8ના મોત થયા હતા. એજ રીતે નોવા સ્કોશિયામાં નવા 65, તથા મોનીટોબામાં 603 તથા સાસ્કેચવાનમાં 146 દર્દી કોરોના પોઝિટિવ રહ્યા હતા. જ્યારે બ્રિટિશ કોલંબિયામાં ગુરુવારે કોરોનાથી સંક્રમિત થયેલા નાગરિકોની સંખ્યા 357 નોંધાવા સાથે 3 દર્દીના મોત કોરોનાને કારણે જ થયા હતા. આ ઉપરાંત અલબર્ટામાં નવા 812 દર્દી વાયરસની ચપેટમાં આવ્યા હતા. ગુરુવારે અલબર્ટામાં વધુ 4 દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો.

વેક્સીનેશન ઝુંબેશનું નેતૃત્વ જનરલ બ્રોડીને સોંપાયું

તપાસને પગલે મેજર જનરલ ફોર્ટીને પદ છોડવાની ફરજ પડી હતી

ઓટાવા : ફેડરલ સરકારે નેશનલ કોવિડ-19 વેક્સીન ઝુંબેશનું નેતૃત્વ પબ્લિક હેલ્થ એજન્સી ઓફ કેનેડાના વડા બ્રિગેડિયર જનરલ ક્રિસ્ટા બ્રોડીને સોંપવાની જાહેરાત કરી હતી. જે જવાબદારી અગાઉ મેજર જનરલ ડેની ફોર્ટીને સંભાળતા હતા. સોમવારે સાંજે કેનેડીયન આર્મ્સ ફોર્સીસ અને ડીપાર્ટમેન્ટ ઓફ નેશનલ ડિકેન્સ સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી હતી. જેમાં ગયા શુક્રવારે મેજર જનરલ ફોર્ટીને તેમની સામેની સેનાની તપાસને પગલે પદ છોડવાની ફરજ પડી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મીડિયાના અગાઉના વિશેષ અહેવાલમાં જણાવ્યું હતું કે, ફોર્ટીને સામે જાતિય શોષણ અને ગેરવર્તનના આક્ષેપો વર્ષ 1987માં થયા હતા.



ફોર્ટીને તેના બચાવ પક્ષના વકીલ કમાન્ડર માર્ક લેટોન્યુની મદદથી આ આક્ષેપોનો ઈન્કાર કરી એને સાવ ખોટા અને પાયા વિહોણા ગણાવ્યા હતા. ક્રિસ્ટા બ્રોડી પીએચએસીમાં વર્ષ 2020થી બીજા ક્રમે હતા અને ફોર્ટીનેની સાથે મળીને 30 સભ્યોની કેનેડીયન આર્મ્સ ફોર્સીસની ટીમમાં હતા. જેમાં ઓપરેશનલ પ્લાનર્સ, ફાર્માસીસ્ટ, હેલ્થકેર એડમિનિસ્ટ્રેટર્સ, એન્જનીયર્સ અને આઈટી એક્ષપર્ટ્સ હતા. એજન્સીના જણાવ્યા મુજબ બ્રોડી થોડા સમય પહેલા જ કેનેડીયન આર્મ્સ ફોર્સીસ સાથે જોડાયા હતા અને ફેબ્રુઆરીથી તેઓ કમાન્ડર ઓફ મિલીટરી પર્સનલ જનરેશન ગ્રૂપ તરીકે કાર્યરત હતા અને વેક્સીન ઝુંબેશમાં તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો.

એપ્રિલમાં હાઉસિંગ માર્કેટમાં મંદી છતાં મકાનના ભાવમાં સતત વધારો નોંધાયો

ઓન્ટેરિયો

કેનેડામાં કોવિડ -19 મહામારીની અસર રૂપે હાઉસિંગ માર્કેટમાં એપ્રિલ માસમાં આંશિક મંદી જોવા મળી હતી. જો કે, આમ છતાં સરેરાશ વેચાણ કિંમતમાં વધારો થતો રહ્યો છે. જે આશ્ચર્યજનક બાબત છે.

ધી કેનેડીયન રીયલ એસ્ટેટ એસોસિયેશને સોમવારે જણાવ્યું હતું કે, એપ્રિલમાં મકાનોના વેચાણમાં 19.4 ટકા જેટલો ઘટાડો ગયા મહિનાની સરખામણીમાં નોંધાયો હતો. કેનેડીયન રીટેલર્સ જુથના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, દેશભરમાં બધા માર્કેટમાં અંદાજે 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ઓન્ટેરિયો અને બ્રિટિશ કોલંબિયાનો પણ સમાવેશ થાય છે. કેનેડાના હાઉસિંગ માર્કેટમાં જો કે ઘણી પ્રવૃત્તિ જોવા મળી હતી એમ કેનેડીયન રીયલ એસ્ટેટ એસોસિયેશનના પ્રમુખ ક્લિફ સ્ટીવન્સને

કહ્યું હતું. કોવિડ -19 મહામારી બાદ બેંકોએ ધિરાણના વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો હોવાથી બજારમાં આ તેજ જોવા મળી હતી. ઘણાં લોકોએ વર્ક ફ્રોમ હોમને કારણે ઓફિસ સાથેનું હોય એવા ઘર ખરીદવાનું પસંદ કર્યું હતું. બ્રિટિશ

બેંકોએ ધિરાણના વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો હોવાથી ઉંચા ભાવે થઈ રહેલી મકાનની ખરીદી

કોલંબિયાના પીટ મેડોઝ વિસ્તારમાં રહેનારા જોશ કલેસ્કોવિક પરિવારને એ જ વિસ્તારમાં મકાન લેવું હતું. તેમણે છ આંકડાનું ડાઉન પેમેન્ટ ભરીને તેમણે પોતાની પસંદગીનું મકાન મેળવ્યું હતું. એજન્ડે તેમને ઘણાં વિકલ્પો બતાવ્યા હતા. છતાં તેમણે પોતાની પસંદગીનું જ મોંઘુ

મકાન લીધું હતું એ જોતા ખ્યાલ આવે છે કે લોકો દેવું કરીને પણ મોંઘા મકાનો ખરીદી રહ્યા છે. આમ મહામારી બાદ પણ લોકો મકાનો ખરીદી રહ્યા હોવાથી બજારમાં તેજ રહી હતી. નિષ્ણાંતો માની રહ્યા છે કે, છેલ્લા બે ત્રણ માસની તેજ બાદ આવેલી મંદી એમ પણ સુચવે છે કે, આવનારા સમયમાં તેજ પાછી આવી શકે છે. આ વર્ષના માર્ચ માસમાં સૌથી વધુ હલચલ આ માર્કેટમાં જોવા મળી હતી. એમ ટીડી બેન્કના અર્થશાસ્ત્રી રીશી સોંધીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, અભ્યાસ માટે હજુ વધુ મહિનાઓના આંકડાઓની જરૂર પડશે અને તો જ ખરેખર ખબર પડી શકશે કે બજાર ફરીથી ઉંચું જશે કે નહીં. કેનેડામાં મકાનની સરેરાશ કિંમત એપ્રિલમાં ૬૯૬૦૦૦ યુએસ ડોલર હતી. જે આ જ સમયગાળામાં ગયા વર્ષની સરખામણીમાં ૪૧.૯ ટકા વધુ હતી.

વેક્સીન માટે મોટર માર્ગે અમેરિકા જાય તો ક્વોરન્ટાઈનને ટાળી શકશે

તબીબી સેવા માટે વિદેશ જવાની છૂટ હોવાથી લાલ મળી શકશે

ટોરોન્ટો

કેનેડીયન રેસીડેન્ટ્સને કોવિડ -19ની વેક્સીન લેવા યુએસ જશે તો પરત કર્યા બાદ ક્વોરન્ટાઈનથી મુક્તિ મળશે એમ પબ્લિક હેલ્થ એજન્સી ઓફ કેનેડાએ સ્પષ્ટ કર્યું હતું. જો કે આ માટે કેટલીક શરતોનું પાલન જે તે નાગરિકે કરવાનું રહેશે. જેમાં કેનેડાના લાયસન્સડ હેલ્થ કેર પ્રોવાઈડરની લેખિતમાં ભલામણ જરૂરી હશે અને સામે પક્ષે અમેરિકાના વેક્સીન પ્રોવાઈડરની લેખિત મંજૂરી પણ જોઈશે. ફેડરલ સરકારના ક્વોરન્ટાઈનના નિયમોમાં જે છૂટછાટો છે તેમાં અમેરિકા સાથેની સરહદ પાસેના પ્રાંતોના લોકોને તબીબી સેવા માટે વિદેશ જવાનો સમાવેશ હોવાથી તેઓ

આ છૂટછાટ મેળવી શકશે. જેનો લાભ માત્ર મોટરમાર્ગે જનારાઓને જ મળી શકશે. આ વિશેની જાણકારી ફેડરલ સરકારની વેબસાઈટ પર મુકાઈ છે. જેને પબ્લિક હેલ્થ એજન્સીના વિન્ડસર રીજિયોનલ હોસ્પિટલના ડેવિડ મસીએ ઈ મેલથી સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિન્ડસર પ્રાંતના લોકો સરળતાથી ડેટ્રોઈટ જઈને વેક્સીન મુકાવી શકે એમ છે તો તેમને મોટરમાર્ગે જવાની છૂટ આપવી જોઈએ. આ સાથે જ ક્વોરન્ટાઈનથી પણ મુક્તિ આપવી જોઈએ. વેક્સીન લઈને પાછા ફરતી વખતે માર્ક ફરજિયાત પહેરવો જરૂરી બનશે એવી સ્પષ્ટતા પણ વિભાગે કરી હતી. હેલ્થ કેનેડાએ એ વાતની પણ નોંધ લીધી હતી કે, યુએસ બોર્ડરના એજન્ડોએ મંજૂરી આપી હોવાથી જ આ શક્ય બનશે. જોકે એને માટે કેનેડાની બોર્ડર એજન્સીએ ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ અંગે લેખિત પ્રમાણ આપવું પડશે.

પેલેસ્ટાઈનીઓના સમર્થનમાં મિસિસાગા પંથકમાં દેખાવો

રસ્તા પર ટ્રાફિક અટકાવી ફટાકડા ફોડયા બાદ દેખાવકારોએ ઝંડા લહેરાવ્યા



મિસિસાગા : મંગળવારે સાંજે મિસિસાગાના માર્ગો ઉપર હજારો લોકોએ દેખાવો કરીને મધ્ય પૂર્વના ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પેલેસ્ટાઈનીઓ પર થતાં અત્યાચારનો વિરોધ કર્યો હતો. આ દેખાવો પેલેસ્ટાઈન કેનેડીયન કમ્યુનિટી સેન્ટર મિસિસાગાએ સેલીબ્રેશન સ્કવેર ખાતે યોજાયા હતા. જે બાદમાં ઓન્ટો બર્ન હેમ્થોર રોડ સુધી પહોંચ્યા હતા અને ટ્રાફિક રોકી દીધો હતો. રસ્તા ઉપર ફટાકડા પણ ફોડયા હતા. દેખાવકારોએ ઝંડા લહેરાવી અને 'મુક્ત પેલેસ્ટાઈન' અને ' પેલેસ્ટાઈન ક્યારેય ખતમ નહીં

થાય' ના સૂત્રોચ્ચારો કર્યો હતા. ટવીટર પર પેલેસ્ટીયન કેનેડીયન કમ્યુનિટી સેન્ટર મિસિસાગા જે પેલેસ્ટાઈન હાઉસ તરીકે જાણીતું છે એણે કહ્યું હતું કે આ દેખાવો ગાઝા પટ્ટીની ઘટનાઓ અને પેલેસ્ટાઈનઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં યોજાયા છે.

બીજી તરફ ઈઝરાયેલ એમ કહે છે કે, આ ઘટનાઓ ગાઝા પટ્ટી આસપાસ રહેતા હમાસ નામના આતંકી સંગઠનના હુમલા બાદની જવાબી કાર્યવાહી જ છે. એમાં જેમના મૃત્યુ થયા છે એ ઈરાદાપૂર્વકના નહોતા.

ઓન્ટેરિયોની હોસ્પિટલોને ઈમરજન્સી સિવાયની સર્જરી કરવા પણ છૂટ અપાશે

ચીફ મેડિકલ ઓફિસરે હેલ્થ કેર પ્રોવાઈડર્સને પત્રથી જાણ કરી, કોવિડના કેસ ઘટવા માંડતા નિર્ણય કરાયો

ટોરોન્ટો

પ્રાંતમાં ઈમરજન્સી સિવાયની સર્જરી કરવા ઉપર રોક લગાવાઈ હતી. આ પ્રતિબંધને હાલ હટાવી લેવામાં આવ્યો છે અને ઓન્ટેરિયોની કેટલીક હોસ્પિટલને બિન તાકિદની સર્જરીઓ શરૂ કરવા મંજૂરી અપાઈ છે. એપ્રિલની 20મી તારીખથી બધી હોસ્પિટલને તાકિદ કરાઈ હતી કે, ઈમરજન્સી સિવાયની સર્જરી ટાળવી અને હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે જગ્યા રાખવી. પરંતુ હવે બુધવારે ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. ડેવિડ વિલિયમ્સે હેલ્થ કેર પ્રોવાઈડર્સને પત્રથી જાણ કરી હતી કે, તેઓ હવે નવા કેસોને તેમની હોસ્પિટલમાં દાખલ કરી શકશે અને બિન તાકિદની સર્જરી પણ કરી શકશે. આ એવો સંકેત ગણાય કે, પ્રાંતમાં હવે સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ પાછળથી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ છૂટછાટ આખા પ્રાંત માટેની નથી. પરંતુ જે વિસ્તારોમાં હોસ્પિટલની ક્ષમતા વધુ છે અને સંક્રમણ ઓછું છે એ વિસ્તારો માટે જ છે. એનો અર્થ એવો પણ થઈ શકે કે, ગ્રેટર ટોરોન્ટો



વિસ્તારની હોસ્પિટલોએ હજુ પણ કોવિડ-19ના દર્દીઓને જ પ્રાથમિકતા આપવી પડશે.

કેમ કે ત્યાં સંખ્યા વધુ છે. પત્રમાં વિલિયમ્સે એમ પણ જણાવ્યું હતું કે, અમે ધ્યાન પૂર્વક બિન તાકિદની સેવાઓ શરૂ કરી રહ્યા છીએ અને કોવિડ -19ના કેસો પર અમારું ધ્યાન રહેશે જ. અમે પુરી તાકાતથી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ અને હેલ્થ સિસ્ટમના અમારા પાર્ટનર્સ પણ પુરો સહકાર આપી રહ્યા છે. એપ્રિલની 20મીએ જ્યાં 2350 કોવિડના દર્દીઓ હોસ્પિટલમાં હતા, જે ઘટીને હવે 1809 જેટલા થઈ ગયા છે. આઈસીયુનો ધસારો હજુ જોવા મળી રહ્યો છે પણ મહિનાના આરંભે ૮૦૦ની સામે અત્યારે ૭૩૫ દરદીઓ આઈસીયુમાં છે. આમ સ્થિતિમાં સુધારાના સંકેતો હોવાથી થોડી છૂટછાટ હોસ્પિટલને અપાશે.

વેક્સીન પ્લાન્ટ માટે સરકાર ૨૦૦ મિલિયન ડોલર આપશે

કંપનીના વિસ્તૃતિકરણથી 500 રોજગારી ઉભી થશે : નવા પ્લાન્ટમાં વર્ષે 112 મિલિયનથી 640 મિલિયન વેક્સિનના ડોઝ તૈયાર કરી શકાશે

ટોરોન્ટો : ફેડરલ સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ મિસીસાગા ઓન્ટેરિયો સ્થિત કંપનીમાં એમઆરએનએ વેક્સિનના પ્લાન્ટના બાંધકામ પાછળ ૨૦૦ મિલિયન યુએસ ડોલરનું રોકાણ કરાશે. ઈનોવેશન મિનીસ્ટર ફ્રાન્કોઈસ ફિલિપ ચેમ્પને કહ્યું હતું કે, આ નાણાંનો ઉપયોગ રીઝીલીયન્સ બાયોટેકનોલોજીસ આઈએનસીની માલિકીની કંપનીની હાલની અને ભવિષ્યમાં થનારા એક્સપાન્શન માટે થશે. જેનાથી વેક્સિન અને આવનારી મહામારી સામે ટકી રહેવાની સારવાર માટેના ઉપકરણો બનશે. તેમણે એમ પણ

કહ્યું હતું કે, હાલમાં કોવિડ-૧૯ સામે અપાતી વેક્સિન એમઆરએનએ વેક્સિન આ જ કંપની બનાવે છે જે મેડ ઈન કેનેડા ગણાય છે. આ કંપનીના વિસ્તૃતિકરણથી ૫૦૦ જેટલી કામચી રોજગારી ઉભી થઈ શકશે અને કામ પૂર્ણ થયેથી વર્ષ ૨૦૨૪ બાદ દર વર્ષે ૫૦ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ પણ મળી શકશે. આ કંપનીની વધારાની ૫૫૦૦૦ ચો.ફૂટ જમીન ઉપર નવો પ્લાન્ટ તૈયાર થશે. જે દર વર્ષે અંદાજે ૧૧૨ મિલિયનથી ૬૪૦ મિલિયન વેક્સિનના ડોઝ તૈયાર કરી શકશે. જેનો આશય કેનેડાએ વિદેશી વેક્સિન ઉપર આધારીત



ન રહેવું પડે એવો છે. આ કંપની પણ એસ્ટ્રાઝેન્કા, મર્ક અને ફાઈઝર જેવી જ ગુણવત્તાવાળી દવાઓ બનાવવાની

ક્ષમતા ધરાવે છે. એ જોતા આવી કંપનીઓ જ્યારે આઉટ સોર્સિંગ માટે અન્ય ઉત્પાદકની શોધ કરતી હોય

ત્યારે આ કંપનીની તકો વધી જાય છે. હાલમાં તો સીડીએમએ કેનેડામાં પુરતી વેક્સિનનો જથ્થો પુરો પાડી રહી છે. મીડિયાના પાવર એન્ડ પોલીટીકસ કાર્યક્રમમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે ફેડરલ સરકારે આ રોકાણ ચાર દાયકાઓ બાદ કર્યું છે જે દેશમાં બાયો મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં થયું હોય. સરકાર અને પ્રાઈવેટ સેક્ટર સાથે મળીને કેનેડાના લાઈફ સાયન્સ સેક્ટરને વિકસાવવાનો પ્રયાસ કરે છે. કેમ કે, વેક્સિન ઉત્પાદકોને સમજાવવામાં સરકારને ઘણી મુશ્કેલી નડી છે. એને ટાળવા આ પ્રયાસ કરાયો છે.

ઓન્ટેરિયો સરકાર નવા રિ-ઓપનિંગ પ્લાનમાં પ્રાંતીય નિયમોથી દૂર રહેશે

ટોરોન્ટો

ઓન્ટેરિયોની સરકારે એવા સંકેતો આપ્યા છે કે, તેઓ હવે પ્રાંતીય ધોરણોથી દૂર રહીને રીઓપનિંગ પ્લાનમાં આગળ વધશે અને એના આધારે પ્રતિબંધો હટાવશે. જે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લાદવામાં આવ્યા હતા. હવે સેક્ટર મુજબ છૂટછાટો અપાશે. આ જાણકારી સોલીસીટર જનરલ સિલ્વીયા જોન્સે ક્વીન્સપાર્કમાં બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલના જવાબમાં આપી હતી. પહેલાં જે કલરકોડ મુજબના

નિયંત્રણો હતા, તેને ધ્યાનમાં રાખીને છૂટછાટો આપવાની યોજના હતી. પરંતુ હવે નવી યોજના મુજબ સેક્ટર મુજબ

સેક્ટર મુજબ છૂટછાટો આપવા હિલચાલ

છૂટછાટો અપાશે. જેથી ઓન્ટેરિયોના અર્થતંત્રને પણ વેગ મળી શકશે. મિનીસ્ટર ઓફ હેલ્થના સુચન મુજબ વિસ્તારને ધ્યાનમાં રાખવાને બદલે હવે સેક્ટરને ધ્યાનમાં રખાશે એમ પણ જોન્સે જણાવ્યું હતું. ધી પ્રોગ્રેસીવ કન્ઝર્વેટીવ

સરકારે અગાઉ ઘણા બિઝનેસ બંધ કરાવ્યા હતા અને આરોગ્યલક્ષી પ્રતિબંધો દરેક પ્રાંતની સ્થિતિ મુજબ લાદ્યા હતા. જેની સામે ઓન્ટેરિયોના પ્રિમીયર ડગ ફોર્ડે એવું સુચન કર્યું હતું કે, વાઈરસનો ફેલાવો જુદી જુદી રીતે થતો હોવાથી કેટલાક બિઝનેસને ફરીથી શરૂ કરવાની મંજૂરી અપાવી જોઈએ. જો કે, જોન્સે બુધવારે કહ્યું હતું કે, ઓન્ટેરિયોનો રીઓપનિંગ પ્લાન સેક્ટર આધારિત હશે. જેમાં જોખમોને ધ્યાનમાં રાખીને એક પછી એક એમ બધા સેક્ટરના બિઝનેસને શરૂ કરવાની મંજૂરી અપાશે.

પ્રિન્સ અલ્બર્ટ સાસ્કાટુનની જંગલની ભીષણ આગમાં અનેક ખેતરો ચપેટમાં

9000થી વધુ ગ્રાહકોનો વીજપુરવઠો ખોરવાયો

સાસ્કાટુન

સોમવારે સાસ્કાટુનથી ઉત્તરપૂર્વમાં ૧૩૫ કિ.મી.ના અંતરે લાગેલી ભીષણ આગમાં ઘણાં ખેતરો ચપેટમાં આવી ગયા હતા. પૂર્વ અને દક્ષિણ દિશાનું આકાશ લાલચોળ દેખાતું હતું. ફિશરનું ફાર્મ જ્યાં આવેલું છે એ જગ્યા નિસ્ખેટ જંગલને અડીને આવેલી છે. પ્રિન્સ અલ્બર્ટ અને ગ્રામીણ મ્યુનિસિપાલિટી ઓફ બકલેન્ડે કટોકટી જાહેર કરી દીધી હતી અને હજારો લોકોનું સ્થળાંતર

કરાવવામાં આવી રહ્યું છે. આ જંગલની આગ સોમવારે બપોરે શરૂ થઈ હતી, જેને કલોવરડેલ ફાયર નામ અપાયું છે. સાંજ સુધીમાં આ આગ ચાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જેમાં અંદાજે ૫૬૮૪ હેક્ટરનો સમાવેશ થાય છે. સાસ્કેચેવાન પબ્લીક સેફ્ટી એજન્સીના ઉપપ્રમુખ સ્ટીવ રોબર્ટ કહ્યું હતું કે, બચાવ ટુકડીએ તે સમયે ૩૦ સે. તાપમાન અને કલાકના ૪૦ કિ.મી.ની ઝડપે વહેતા પવનમાં કામ કરવું પડ્યું હતું. સાસ્ક પાવરના પ્રવક્તા જોએલ ચેરીએ જણાવ્યું હતું કે, ૮૦૦૦થી વધુ ગ્રાહકોનો વીજપુરવઠો ખોરવાયો હતો.

અમેરિકન સંસદ ઉપર હુમલાની તપાસના કમિશનના બિલને ૩૫ રિપબ્લિકનોનો ટેકો

વોશિંગ્ટન

કેપિટલ હિલ પર છટ્ટી જાન્યુઆરીએ થયેલા હુમલાની તપાસ કરવા માટે દ્વિપક્ષીય પંચની રચના કરવાના મતદાનમાં ૩૫ રિપબ્લિકનોએ ડેમોક્રેટ્સને સમર્થન આપ્યું હતું. તેઓએ આના પગલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુસ્સાનો અને જીઓપીના નેતાના આકરા વલણનો સામનો કરવો પડી શકે છે, જેમણે આ દરખાસ્તને અયોગ્ય ગણાવી હતી. ન્યૂયોર્કના રેપ. જોન કેટકોની આગેવાની હેઠળના રિપબ્લિકન નેતાઓએ હોમલેન્ડ સિક્યોરિટીના ચેરમેન બર્ની થોમ્પસન, ડી-મિસને આના પગલા લેવા માટે લખ્યું હતું. પેનલના ટોચના રિપબ્લિકન કેટકો તાજેતરમાં કોંગ્રેસનો પાર સહન કરવો પડ્યો છે કેટકોએ જણાવ્યું હતું કે રિપબ્લિકન્સ અને

ડેમોક્રેટ્સ સહિત હું બધા સભ્યોને વિનંતી કરું છું કે તેઓ ફક્ત એક વખત માટે તેમના મતભેદો બાજુએ મૂકીને આ બિલને ટેકો આપે. ભૂતપૂર્વ પ્રોસિક્યુટર કેટકોએ પ્રસ્તાવિત કમિશન રચવાની જરૂરિયાતને રમખાણને સમજવા માટેનું મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ કેવી રીતે થયું અને ભવિષ્યમાં આ પ્રકારના હુમલાને પહોંચી વળવા માટે કેવા પ્રકારની સલામતી વ્યવસ્થા હોવી જોઈએ તેના માટે કમિશન રચવું મહત્વનું છે. તેમણે કહ્યું હતું કે આ વાત હકીકતની છે, પક્ષીય રાજકારણની વાત નથી. આમ ૩૫ જેટલા રિપબ્લિકનોનું સમર્થન હજી નાનો આંકડો હોવા છતાં પણ રિપબ્લિકનોનો ઘણો મહત્વનો આંકડો કહી શકાય, કારણ કે ૧૭૫ રિપબ્લિકન પ્રતિનિધિઓએ આ બિલનો વિરોધ કર્યો છે.

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

INVEST WITH Metrobuild Capital
Sharia'h Compliant

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects plus your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- Residential
- New Construction
- Investment
- Commercial

MOHAMMAD ABOWATH SALES REPRESENTATIVE
MAAZ ABOWATH BROKER
IBRAHIM ABOWATH SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH
REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX CROSSROADS REALTY INC. #SellwithABOWATH your Local REALTOR

*Not intended to Solicit client under contract.

The North Star Insurance Inc.
For all your Insurance & Investment needs

Are you planning to invite family members to Canada?
Are you planning to travel outside Canada?

Visitors Insurance
Travel Insurance
Super Visa Insurance

* Pre existing medical conditions coverage * Monthly pay plans
* Full refund if visa denied * Pro rated refund for early return
* Reduced premium plans with deductible

Make your investment plans, meaningful with T.F.S.A RRSP RESP

Protect Yourself, your family, investment & your valuable assets through

Life Insurance
Critical Illness Insurance
Disability Insurance

Call today for a free no obligation quote

Jagdish Patel
(Agency Owner, Insurance Advisor)
647-470-1673
northstar.inc19@gmail.com

Better Commission package
One on one basis support

Hiring new & experienced insurance advisor

Weekly product training
Full flexibility



તંત્રી સ્થાનેથી

કોરોનાકાળમાં 'તાઉતે'નો કેર પાંચ રાજ્યોમાં વેર્યો વિનાશ

અરબ સાગરમાં આકાર લઈને ગુજરાત સહિત ભારતના પશ્ચિમ તટે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે.



તંત્રી - પ્રકાશક
સ્વદેશ

કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં વાવાઝોડા સાથે જ વરસાદ તૂટી પડતા 79થી વધુ લોકોના મોત થવા સાથે અબજો રૂપિયાનું નુકસાન થયું છે. આધુનિક ટેકનોલોજી અને હવામાનની દેખરેખ

રાખતા સેટેલાઈટોની મદદથી વાવાઝોડા જેવી કુદરતી આફતોની આગોતરી જાણકારી મેળવવામાં આ વખતે સફળતા મળી છે. જેને કારણે અડધી નુકસાનીને ટાળી શકાય છે. આમ છતાં કુદરતી આફત સામે માનવીની લાચારી ફરી દેખાય હતી. 15 મહિનાથી કોરોના સામે ઝડૂમી રહેલા ભારતમાં મ્યકોરમાઈકોસીસ નામનો રોગ, બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ જેવી મુશ્કેલી યથાવત છે. આ સાથે જ દેશમાં આર્થિક સંકટ પણ ઘેરાય રહ્યું છે.

બરાબર આ જ સમયે કુદરત પણ રુઠી હોય તેમ ભારત પર તાઉતે નામના વાવાઝોડાની આફત આવી છે. દેશના પશ્ચિમ કાંઠે તાઉતે નામનું ભયાનક વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં હોવાની આગાહી પહેલાથી જ હવામાન ખાતાએ કરી હતી. આ વાવાઝોડું અરબ સાગરમાં આકાર લઈ રહ્યું છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ત્રાટકી શકે છે તેવી શક્યતા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી હતી.

સાથે જ વાવાઝોડાના કારણે ભારે વરસાદની ચેતવણી તો કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધીના પશ્ચિમી તટના રાજ્યોમાં આપવામાં આવી હતી. જે બાદ ગત રવિવારથી જ આ આગાહીની અસર વર્તાવા માંડી હતી. કેરળ અને તે પછી મહારાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મહારાષ્ટ્રમાં સોમવારે સવારે તેની વ્યાપક અસરમાં 120 કિમીની ઝડપે તોફાને ત્રાટક્યું અને 29 લોકોનો જીવ લઈ લીધો. આ સમયે મુંબઈમાં 180 કિમીની ઝડપે પવન ફુંકાયો અને દરિયાના મોજા 13 ફુટ કરતા પણ વધુ ઉછળ્યા. આ સમયે દરમિયાન જહાજ ફસાતા 261માંથી 188ને ઉગારાયા હતા. આ પહેલા આ વાવાઝોડાએ ગોવામાં 100થી વધુ મકાનોને જમીનદોસ્ત કર્યા હતા તો કેરળમાં કાંઠા વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. કર્ણાટકમાં આ વાવાઝોડાથી 121 ગામોમાં ખાનાખરાબી સર્જાઈ હતી.

આ રાજ્યોને ઘમરોળ્યા બાદ આગાહી મુજબ તેનું આગમન ગુજરાતમાં થયું હતું. સૌરાષ્ટ્રના ઉના પાસે ટકરાયેલા આ વાવાઝોડામાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપ કરતા પણ વધુ ઝડપે પવન ફુંકાયો હતો. જેની સીધી અસર દ.ગુ. અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી હતી. ગુજરાતમાં આ વાવાઝોડાની અસર સૌથી વધારે વર્તાઈ છે. બે દિવસ સુધી ગુજરાતમાં 2થી 12 ઈંચ સુધીનો વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જ્યારે વાવાઝોડા સાથેના વરસાદે ખેતીને તહસનહસ કરી નાંખી છે. કેરી, ડાંગર, મગ, શાકભાજી સહિતના પાકોને 4000 કરોડ કરતા પણ વધુનું નુકસાન થયું છે. આ ઉપરાંત પશુઓના મોતની ઘટનાઓ પણ સૌરાષ્ટ્રમાં નોંધાઈ છે.

જ્યારે આ જ તોફાનમાં વીજ સેક્ટર સૌથી વધુ નુકસાન વેઠવાની નોબત આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યના 2225 કરતા પણ વધુ ગામોમાં 48 કલાક કરતા વધુ સમય વીજળી ડુલ રહી હતી. કારણ કે વાવાઝોડા અને વરસાદમાં 70 હજાર વીજપોલ ધ્વસ્ત

થઈ ગયા હતા. આ સાથે ઝાડ તૂટી પડતા રાજ્યના 224 માર્ગો પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જો કે, કોરોના સામે લડવામાં સાવ પાણી વિનાના પુરવાર થયેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાવાઝોડા સામે લડવામાં સતર્કતા બતાવી હતી એ કબૂલવું પડે. તેમણે પહેલેથી સાબદાં થઈને વર્તવા માંડ્યું તેમાં આ વખતે વહીવટીતંત્ર પણ એકદમ મજબૂત સાબિત થયું.

વિજય રૂપાણીએ પોતે મોરચો સંભાળ્યો અને વાવાઝોડું ત્રાટકે તે પહેલા હજારો લોકોના સ્થળાંતર કરાવી લીધા હતા. જેને કારણે રાજ્યમાં આટલા મોટા વાવાઝોડા પછી મૃત્યુ આંક 50 ઉપર જ સમેટાઈ ગયો હતો. આ વખતે રૂપાણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાવવાથી માંડીને લોકોને સતત માહિતગાર રાખવા સુધીની કામગીરી અસરકારક રીતે નિભાવી છે. આ ઉપરાંત અનેક લોકોએ પોતાની રીતે સલામતીની વ્યવસ્થા પણ કરી હતી. ગુજરાતમાં વિનાશક 'તાઉ તે' વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયા બાદ આખા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિનાશ વેર્યો છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એ ચાર મોટાં શહેરમાં જ ત્રણ હજાર કરતાં વધુ ઝાડ પડી ગયાં હતા. જ્યારે આ ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ પડવાની તો ગણતરી પણ કરી શકાય નથી. આ વાવાઝોડામાં રાજ્યમાં હજારો લોકોના ઘરોનાં છાપરાં ઊડી ગયાં અને હજારો લોકો સાવ બેઘર બની ગયાં. રાજ્યમાં કુલ ૧૮ હજાર ગામડાં છે તેમાંથી પચાસ ટકા એટલે કે ૯ હજાર ગામડાંને અસર થઈ છે. મધ્ય ગુજરાતને બાદ કરતાં ગુજરાતના બાકીના તમામ વિસ્તારોને વાવાઝોડાએ મોટો ફટકો માર્યો છે.

ગુજરાતમાં આ સમયગાળો લણણીનો હતો. ત્યારે ખેતરોમાં ડાંગર, ઉનાળુ બાજરી, મગ, અડદ, તલ અને જુવાર એ છ મુખ્ય પાક ઊભા હતા. વાવાઝોડાથી આ તમામ પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. સરકારે લોકોને ચેતવણી આપી હતી તેથી લોકો શક્ય હોય તેટલો પાક સલામત સ્થળે ખસેડ્યો હતો. પરંતુ આમ છતાં ખેતરમાં ઉભેલા પાકને મોટું નુકસાન થયું છે. બાગાયતી પાકો તો સાવ નષ્ટ થઈ ગયા છે. સામાન્ય રીતે વાવાઝોડું એક દિવસ અને બહુ બહુ તો બે દિવસમાં પસાર થઈ જતું હોય છે.

ગુજરાત સહિતના રાજ્યોને તાઉ તે વાવાઝોડાને કારણે પડેલો આર્થિક ફટકો સરભર કરવા હવે વર્ષો નીકળી જશે. આ વખતે ગુજરાતની સ્થિતિ જાણીને ખુદ વડાપ્રધાને બુધવારે હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો અને તે પછી અમદાવાદમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠક બાદ મોદીએ ગુજરાત માટે 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી હતી. આ સાથે જ વાવાઝોડાને કારણે જીવ ગુમાવનારાઓને બે લાખ તથા ઈજાગ્રસ્તોને 50 હજારનું વળતર આપવા પણ નિર્ણય કરાયો છે. બીજી તરફ મોદી દિલ્હી ગયા બાદ રાજ્યના સીએમ રૂપાણીએ કેશડોલની ચુકવણીની જાહેરાત કરીને અસરગ્રસ્તોને મદદની ખાતરી આપી હતી. દેશમાં તાઉ તે નામના વાવાઝોડાના સમાચાર હજી તાજા જ છે ત્યાં હવે બંગાળ અને ઓરિસ્સામાં યાસ નામનું વાવાઝોડું 26મી મે સુધીમાં ત્રાટકવાની આગાહી કરાઈ છે. જેને કારણે સરકાર ફરી ચિંતામાં મુકાઈ છે. આ વખતે યાસની ઝડપ પણ 150 કિમી પ્રતિ કલાક રહેવાનો અંદેશો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

RE/MAX
REALTY SERVICES
INC., BROKERAGE
INDEPENDENTLY OWNED AND OPERATED



JAY PATEL
BROKER

647.241.3818
jaypatel1323@gmail.com



"Let Me Make Your Dream
Home Into A Reality"

Residential, Commercial &
Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924
295 Queen Street East, Brampton, On., L6W 3R1



ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice
✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach
✓ Bedbug
✓ Animal Control

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



✓ Bird Control
✓ WASPS and
✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES
AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And
Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



મ્યુકોરમાઈકોસિસ વિશે સરકાર ગંભીર બને: હાઈકોર્ટ

બ્લેક ફંગસનો રોગ ગુજરાતમાં ઝડપથી વધી રહ્યો છે: ઈન્જેક્શનોની અછત અને ખર્ચાળ સારવાર અંગે સરકારને રિપોર્ટ આપવા આદેશ

અમદાવાદ

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં કોર્ટે કોરોના બાદ થતા બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકોરમાઈકોસિસ રોગ સામે લડવા રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની શું તૈયારી છે તેનો જવાબ માગ્યો છે. કોર્ટના આદેશમાં જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે સારવાર માટેના જરૂરી ઈન્જેક્શનોની અછત અને ખર્ચાળ સારવાર અંગે સરકાર સ્તવરે અને ગંભીરતાથી વિચારણા કરે તે જરૂરી છે. રાજ્ય સરકારને ૨૪મી મે સુધીમાં

જવાબ આપવા આદેશ કરાયો છે.

કોર્ટે નોંધ્યું છે કે અત્યારે મ્યુકોરમાઈકોસિસ તરીકે ઓળખાતી બ્લેક ફંગસનો રોગ નવા પડકાર તરીકે સામે આવ્યો છે. દસ દિવસમાં આ રોગના કેસ વધ્યા છે. ઈન્જેક્શન અને દવાઓ સરળતાથી બજારમાં મળતા પણ નથી. અરજદારો કહી રહ્યા છે કે આ રાજ્ય સરકારે મ્યુકોરમાઈકોસિસની સારવારમાં વપરાતા પાંચ હજાર ઈન્જેક્શનની ખરીદી કરી છે, પરંતુ આ જથ્થાથી માત્ર ૨૭ દર્દીઓની જ સારવાર થઈ શકે છે અને રાજ્યમાં અત્યારે મ્યુકોરમાઈકોસિસના ૧૦૦ કેસો નોંધાયેલા છે.

સુરતમાં મ્યુકર મઈકોસીસના 180 દર્દી: અત્યાર સુધીમાં 10ના મોત

સુરત: સુરતમાં મ્યુકર મઈકોસીસના હાલમાં દર્દીઓની સંખ્યા 180 છે પરંતુ આ રોગના દર્દીઓ વધી શકે તેમ હોવાથી સિવિલ હોસ્પિટલમાં વોર્ડ વધારવામાં આવ્યા છે અને સ્મીમેટ હોસ્પિટલમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં અત્યાર સુધીમાં આ રોગને કારણે 10 લોકોના મોત થયા છે.

અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઈકોસિસ દર્દીઓ માથે મોતનો ખતરો

અમદાવાદ સિવિલમાં બુધવારે સાંજે છ વાગ્યાની સ્થિતિએ મ્યુકરમાઈકોસિસના ૪૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે, સૂત્રો કહે છે કે, સિવિલમાં રોજના એક હજાર જેટલા ઈન્જેક્શનની જરૂરિયાત સામે સરકાર રોજના માંડ ૧૦૦ જેટલા ઈન્જેક્શન પૂરા પાડે છે, ક્યારેક એય આવતાં નથી, આ સ્થિતિમાં અધિક્યરી સારવારના કારણે સિવિલમાં દાખલ દર્દીઓ માથે મોતનો ખતરો તોળાઈ રહ્યો છે.

ગુજરાતમાં અનેક દર્દીના દાંત-દાઢ સહિત જડબાં કાઢી નંખાયા

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં ૬૨ અને સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં ૧૫ મળી ૧૦૭ દર્દી નોંધાયા છે. જે દર્દીઓના દાંત-દાઢ સહિત જડબું-તાળવું કાઢી નાંખવું પડ્યું છે. તબીબોના નિવેદન પ્રમાણે રાજ્યમાં કોરોનાની બીજી લહેર પછી હવે મ્યુકરમાઈકોસીસનો રોગ દેખાયો છે. અત્યાર સુધીમાં અમદાવાદ ડેન્ટલ હોસ્પિટલમાં ૧૫ દર્દીના દાંત-દાઢ કાઢી નાખવાની નોંખત આવી છે.

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી ૪૭૭૩ નવા કેસ, 64 દર્દીના મોત

અમદાવાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૭૭૩ કેસ નોંધાયા છે. જેની સામે ૮૩૦૮ દર્દીઓ સાજા થયા છે. ગુરૂવારે રાજ્યમાં કોવિડના કારણે ૬૪ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૮૪૦૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૭.૩૨ ટકા છે. અમદાવાદમાં ૧૧૦૬, સુરતમાં ૫૦૬, વડોદરામાં ૫૮૪ રાજકોટમાં ૨૬૪, જામનગરમાં ૨૦૩, ભાવનગરમાં ૧૧૦, જૂનાગઢમાં ૨૧૮, આણંદમાં ૧૬૧, ભરૂચમાં ૧૩૮, કચ્છમાં ૧૩૪, પંચમહાલમાં ૧૨૬, ગાંધીનગરમાં ૧૦૮, સાબરકાંઠામાં ૧૦૫, મહેસાણામાં ૮૭, દાહોદમાં ૮૧, ખેડામાં ૮૮, મહીસાગરમાં ૮૫, તથા પોરબંદરમાં ૮૨ કેસ નોંધાયા હતા.

RT-PCR ટેસ્ટનું પ્રમાણ વધારી ૭૦ ટકા કરવાની રિટ હાઈકોર્ટે ફગાવી દીધી

RT-PCR ટેસ્ટનું પ્રમાણ વધારીને ૭૦ ટકા કરવા માગણી કરતી રિટ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે. અરજદારોએ રજૂઆત કરી હતી કે આર.ટી.-પી.સી.આર. ચોકસાઈ ઘટાવતા હોવાથી તેનું પ્રમાણ વધારવામાં આવે તો સંક્રમણ ઝડપથી કાબૂમાં આવી શકે તેમ છે. જે કે કોર્ટે ICMRની ગાઈડલાઇન અંગે વધુ પૂછ્યા કરતા જાણવા મળ્યું હતું કે ફરજિયાતપણે ૭૦ ટકા RT-PCR કરવા અંગે કોઈ ગાઈડલાઇન નથી. જેને ધ્યાનમાં રાખી કોર્ટે રિટ ફગાવી છે.

"Savings For YOU, Protection for Your Loved Ones"

: Offered services :

1. Life Insurance
2. Mortgage Insurance
3. Critical Illness Insurance
4. Visitors Medical Insurance
5. Tax Return Filing
6. Super Visa Travel Insurance



Shailesh Patel

CALL TODAY

Cell : 416 837 9155

Email : shailesp@gmail.com

We represent many insurance companies, we can shop around for best rates.

THANK YOU FRONTLINE WORKERS



MORTGAGE DILIGENT
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.60%* High Ratio Only
5 Yrs Variable @ 1.14%* High Ratio Only



Rakesh Patel**
Vice President- Commercial.



Pranay Jani *



Nilesh Tailor *



Tushar Patel*



Bala Shah*



Vijay Rana*



Rajesh Khurana, MBA
Principal Broker

Cell : 416-616-1300

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.* FSCO#10252,OAC,E&O.E * - Mortgage Agent, ** - Vice President

* Some conditions apply

જામનગરના ઝાંખર નજીક પ્રેમી દ્વારા જ યુવતીની ફરપીણ હત્યા

જામનગર

મેઘપર પોલીસ મથકના તાબા હેઠળના ઝાંખર પડાણ ગામના ગાડા માર્ગ નજીક ગત તા.14 મેના રોજ અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ મેઘપર પોલીસે આજે ગુનો ઉઠેલી નોંખીને યુવતીની હત્યા અંગે મૃતકના ભાઈના સાળાની અટકાયત કરી છે. પોલીસની તપાસમાં લાશ જામનગરની સ્વામિનારાયણ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી કલ્યાણપુર તાલુકાની સીમાબેન પાંડાવદરા નામની યુવતીની હોવાનું ખુલ્યું હતું. જે બાદ યુવતીના ગુમ થયેલા મોબાઈલની ડિટેઈલની તપાસ થતાં તેના સંપર્કમાં મીઠાપુરનો નાગેશ ઉર્ફે નકશ

મનુભાઈ વેગડા નામનો યુવક વધુ રહેતો હતો. તેથી પોલીસે તેને શંકાના આધારે મીઠાપુર પોલીસની મદદથી સુરજકરાડી રોડ પરથી અટકાયતમાં લઈને પુછપરછ કરતાં યુવક મૃત યુવતીના મોટાભાઈનો સગો સાળો થતો હોવાનું અને બન્ને દોઢવર્ષથી પ્રેમ સંબંધ ધરાવતા હોવાનું અને પોતે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ યુવતી સીમા અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતી હોય જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થતાં તેનું મનદુઃખ રાખીને તા.13ના રોજ પાંભાળીથી બન્ને ફરીને સાથે પરત આવતા હતા, ત્યારે ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપતાં તેને અટકાયતમાં લઈને કોવિડ ટેસ્ટ બાદ તેને વિધિવત અટક કરવા કવાયત થઈ છે.

જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ

ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધતાઉતેષ વાવાઝોડુ ત્રાટકવાની આગાહીના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ભાવન ગજની ધજા આજરોજ અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. દરરોજ જુદા જુદા સમયે પાંચ ધ્વજા દ્વારકાધીશ મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. પર ગજની આ ધ્વજાનું અનન્ય મહત્વ છે.

સૌરાષ્ટ્રની ધરા ફરી ધ્રુજ : એપી સેન્ટર દીવના દરિયામાં

રાજકોટ

રવિવારની મધ્ય રાતે 3:37 કલાકે સૌરાષ્ટ્રમાં 3.8ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જેને કારણે ગભરાટ ફેલાયો હતો. મધરાતે ધરા ધ્રુજતા જ હજારો લોકો નિદ્રામાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. જે બાદ સ્થાનિક તંત્ર અને છેક ગાંધીનગર સિસ્મોગ્રાફી તંત્ર સુધી જાણ કરાઈ હતી. આખરે રિટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.8ની નોંધાઈ હોવાની પૃષ્ઠિ તંત્રએ કરી હતી. આ સાથે જ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દીવના દરિયામાં નોંધાયું હોવાનું પણ જાહેર થયું હતું. મળતી વિગતો મુજબ રવિવારે 6 વાગ્યા આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ધરતીમાં કંપન અનુભવાયા હતા. જેમાં ઉના અને અમરેલીમાં ભૂકંપના આંચકા આવ્યા હોય, લોકોએ તે પોતે અનુભવતા મામલતદાર અને જિલ્લા કલેક્ટરને જાણ કરાઈ હતી.

અમરેલીથી પરત સુરત જતા કાકા ભત્રીજા સહિત 3ના મોત

કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર જતી રહી અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

વડોદરા :

સુરતના ઓલપાડ વિસ્તારમાં સુખમંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઈ ગોકુલભાઈ ગોદાણી (ઉ.વ.૩૬) હાલમાં કોરોના મહામારીમાં સેવા સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા.વતનની વહારે કાર્યક્રમ હેઠળ અશોકભાઈ ગોદાણી અને તેમનો ભત્રીજો સંજય હસમુખભાઈ ગોદાણી (ઉ.વ.૩૯) સુરતથી ત્રણ દિવસ પહેલા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સેવા માટે ગયા હતા.અને ગઈકાલે રાતે તેઓ સૌરાષ્ટ્રથી સુરત પરત આવતા હતા. તેમની સાથે તેમનો એક સંબંધી રાજુ ગીરધરભાઈ ગોંડલિયા (ઉ.વ.૪૨) (રહે.બાંભણીયા, તા.મહુવા,

જિ.ભાવનગર) પણ સુરત આવતો હતો. કાર અશોકભાઈ ચલાવતા હતા. વહેલી સવારે વડોદરા નજીક વાઘોડિયા ચોકડીથી કપુરાઈ ચોકડી જતા રોડ પર અચાનક કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર જતી રહી હતી.તે દરમિયાન સામેથી આવતી એક ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા કારમાં બેસેલા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કડ્ડા મોત થયા હતા. વહેલી સવારે થયેલા ગોઝારા અકસ્માતના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો.બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની એકતરફ કર્યા હતા. અને મૃતકોના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.અને મૃતકો પાસેથી મળેલા ઓળખના પુરાવાના આધારે પોલીસે તેમના સંબંધીને જાણ કરી હતી.મૃતકના સંબંધીઓ બપોરે વડોદરા આવી પહોંચ્યા હતા.

રાજ્યના 36 શહેરોમાં બપોરે ત્રણ સુધી વેપાર-ધંધાને છૂટ, રાત્રિ કફરૂ યથાવત

ગાંધીનગર

કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કફરૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. જોકે, હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. વિજય રૂપાણીએ ૨૧થી ૨૭ મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ૨૧ મેથી ૩૬ શહેરોમાં સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી. કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કફરૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. જોકે, હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી

રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. રૂપાણીએ ૨૧થી ૨૭ મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ૨૧ મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા ૩૬ શહેરોમાં સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જોકે, રાત્રિ કફરૂ યથાવત રાખવામાં આવ્યો છે, તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. ગુજરાતમાં રાત્રિ કફરૂ અને નિયંત્રણોની સમય મર્યાદા ૧૮ મેએ પૂરી થતી હતી પરંતુ રાજ્યમાં ત્રાટકેલા તૈકંતે વાવાઝોડાના કારણે તેને ૨૧ મે સવારે ૯ વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા હતા. સમયથી નાના વેપારીઓ તરફથી માંગ કરવામાં આવી રહી હતી કે તેમને વેપાર-ધંધા કરવામાં થોડી છૂટ આપવામાં આવે. પરંતુ કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે તેમાં કોઈ છૂટ આપી ન હતી. હવે જ્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે અને કેસ તથા મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

નર્મદા નદીમાં ડૂબી જતા મકરપુરાના એક જ પરિવારના ત્રણ મોતને ભેટ્યા

વડોદરા

વડોદરા જિલ્લાના ચાણોદ નજીક કરનાળી કરનાળી ખાતેના સોમનાથઘાટ પર બુધવારે બપોરે ગામની કેટલીક મહિલાઓ કપડા ધોવા માટે ગઈ હતી ત્યારે નર્મદા નદીમાં બે મૃતદેહો તરતા દેખાતા તેમણે તુરંત સ્થાનિક લોકોને જાણ કરતા સ્થાનિક લોકો દ્વારા ચાણોદ પોલીસને ખબર કરવામાં આવી હતી. બપોરે ચાણોદ પોલીસ સોમનાથઘાટ પર પહોંચી ત્યારે ઘાટ પાસે બે મહિલા અને એક પુરુષના ચપ્પલ મળ્યા હતાં જેથી બે મૃતદેહો ઉપરાંત ત્રીજી વ્યક્તિ

પણ ડૂબેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થાનિક તરવૈયાઓ મારફતે નદીમાં તપાસ કરતા એક યુવાનનો પણ મૃતદેહ મળ્યો હતો. બાદમાં તપાસ કરતા ત્રણે મૃતકો વડોદરાના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વડોદરાના મકરપુરા રોડ પર આવેલી નોવિનો કંપનીની સામે સૂર્યકિરણ કોમ્પ્લેક્સમાં રહેતા ભાયલાલ ઈશ્વરભાઈ હરીજનને ચાણોદ બોલાવતા તેમણે પત્ની અને પુત્ર તેમજ પુત્રીનો મૃતદેહ હોવાની ઓળખ કરી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ભાયલાલભાઈ શોકમાં ગરકાવ થઈ ગયા હતાં.

Imperial

PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

All Pest Control:
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets
10% Off
on your first home service
*Mention this offer while booking

Free Estimates &
Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ઉઝા માર્કેટમાં કૌભાંડ ચેરમેન-MLA સામે CIDમાં ફરિયાદ નોંધવા આદેશ

તપાસના નામે બે-બે રજિસ્ટ્રારની નોટફીચી પરિણામ ન આવ્યું

ઉઝા

ઉઝા APMCના 15 કરોડના રોકડ સેસ કૌભાંડ મામલે કોર્ટે કથિત આરોપીઓ ઉઝાના MLA આશા પટેલ, ઉઝા APMC ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ વિરુદ્ધ ગાંધીનગર CID કાર્ડમાં ફરિયાદ નોંધી તપાસ કરવાનો હુકમ બુધવારે કરવામાં આવ્યો છે.

આ કૌભાંડમાં ભાજપના બે બે મોટા નેતા ઉઝાના ધારાસભ્ય આશા પટેલ અને એપીએમસીના જ ચેરમેન અને ભાજપના નેતા એવા દિનેશ પટેલ વિરુદ્ધ જ કૌભાંડ કરવા અને કરાવવાના આક્ષેપો લાગ્યા છે. જે મામલે હવે કોર્ટે ફરિયાદનો હુકમ કરી તપાસ ગાંધીનગર CID કાર્ડમને સોંપી દેતાં ઉત્તર ગુજરાતમાં સોંપો પડી ગયો છે. અરજદાર સૌમિલ પટેલે 8 માસ અગાઉ આ કૌભાંડ મામલે સહકારી માળખાના ખાતાકીય ઉચ્ચ અધિકારીઓ, સરકારના

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી તથા ઉઝા પોલીસ મથકના પી.આઈ.થી લઈ ગાંધીનગર સ્થિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ કૌભાંડની લેખિત ફરિયાદ કરી હતી. છતાં આજ દિન સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. જેથી આખરે અરજદારે કોર્ટમાં આ મામલાની ફરિયાદ નોંધાવે તે માટે અરજી દાખલ કરી હતી. સપ્ટેમ્બર 2020માં જ્યારે ક્લાર્ક સૌમિલ પટેલે 15 કરોડની રોકડ સેસમાં કૌભાંડના આક્ષેપ કર્યા ત્યારે તેની ખાતાકીય તપાસના નામે નાટક શરૂ થયું હતું. જેની પહેલી તપાસ તત્કાલીન મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર દિનેશ પટેલે એવી ચલાવી કે જ્યાં સુધી તેમની બદલી ન થઈ ગઈ ત્યાં સુધી કોઈ રિપોર્ટ તેઓએ કર્યો જ નહીં તો તે બાદ નવા રજિસ્ટ્રાર લોખંડે આવતાં તેઓએ પણ આજદિન સુધી કૌભાંડના આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી.

ફરિયાદ ન નોંધાતા કોર્ટે હુકમ કર્યો- કાપડિયા



સૌમિલ પટેલના વકીલ હર્ષદરાય કાપડિયાએ જણાવ્યું હતું કે ક્લાર્ક સૌમિલ પટેલે અગાઉ આ કૌભાંડ બાબતે વિગતવાર અને પુરાવાઓ સાથે ઉઝા પી.આઈ., વિસનગર

નાયબ પોલીસ અધિક્ષક, મહેસાણા એસપી, જિલ્લા રજિસ્ટ્રાર, ગાંધીનગર નિયામક, મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી સહિત તમામ ઉચ્ચાધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. પરંતુ કોઈએ કાર્યવાહી ન કરતાં આખરે ઉઝા કોર્ટમાં અપીલ કરવી પડી હતી જેના સંદર્ભે ઉઝા કોર્ટે ગાંધીનગર CIDમાં ફરિયાદ નોંધી તપાસ કરવા હુકમ કર્યો છે.

નરિયાદ સંતરામ મંદિર દ્વારા કોરોનાની નિ:શુલ્ક સારવાર

નડિયાદ

ખેડા જિલ્લાના વડામથક નરિયાદમાં આવેલા શ્રી સંતરામ મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનો માટે અવિરત સેવાવ્યાજ્ઞ ચાલી રહ્યો છે. નિ:શુલ્ક કોરોના સારવાર, સીટીસ્કેન રિપોર્ટ પછી મંદિર દ્વારા દર્દીઓને તમામ પ્રકારના તબીબી રિપોર્ટ્સ નિ:શુલ્ક કરી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. સંતરામ મંદિરના પૂ. મહંતશ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી નરિયાદ અને ખેડા જિલ્લાના મધ્યમ અને ગરીબ વર્ગના હજારો દર્દીઓને લાખો રૂપિયાની સેવાઓ મળી રહી છે. શ્રી સંતરામ લેબોરેટરીમાં દર્દીઓને આગામી ૨૦ દિવસ સુધી તમામ પ્રકારના રિપોર્ટ્સ નિ:શુલ્ક કરી આપવામાં આવશે. તે જ રીતે સંતરામ ફિઝિયોથેરાપી સેન્ટરમાં પણ તમામ સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે.

ખેડામાં વીજ તાર પડતાં માતા-પુત્રી અને સાણંદમાં ભાઈ-બહેનનું મોત

ખેડા

તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જ્યું છે. રાજ્યમાં તાઉ તે વાવાઝોડાને કારણે કુલ 9 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં ખેડામાં વીજ વાયર પડતાં માતા અને પુત્રીના મોત નિપજ્યા હતા. જ્યારે સાણંદમાં વીજ વાયર પડતાં ભાઈ અને બહેનનાં મોત નિપજ્યા હતા.

તાઉ તે વાવાઝોડાને કારણે રાજ્યમાં ઠેર ઠેર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકવાને કારણે અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા છે તો તેની સાથે સેંકડો વીજપોલ પણ ધરાશાયી થયા છે. આ વીજવાયર પડવાને કારણે ખેડામાં

બે વ્યક્તિઓનાં તો સાણંદમાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9 લોકોનાં મોત તાઉ તે વાવાઝોડાને કારણે નિપજ્યા છે.

ખેડાના નરિયાદમાં આવેલાં ન્યુ શોરોક વિસ્તારમાં ભારે વાવાઝોડાને કારણે વીજ વાયર સાથે ઝાડ તૂટીને પડ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલાં માતા અને પુત્રી પર આ વીજ વાયર પડ્યો હતો. જેને કારણે ઘટનાસ્થળે જ માતા અને પુત્રીના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નરિયાદ ફાયર બ્રિગેડની ટીમ, નરિયાદ શહેર મામલતદાર, ચીફ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન

મહેસાણા

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન થયું હોવાની માહિતી મળી છે. ટૂંકી માંદગી બાદ માનસિંગ ચૌધરીનું નિધન થયું છે. દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરી 21 દિવસની લડત બાદ કોરોનાને માત આપી હતી. પરંતુ દુર્ભાગ્યવશ માનસિંગ કોરોના માદ મ્યુકરમાઈકોસિસનો ભોગ બન્યા હતા. દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીની સારવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ કોરોનાને હરાવ્યો હતો, કોરોના બાદ માનસિંગ ચૌધરી મ્યુકર માઈકોસિસનો ભોગ બન્યા હતા. તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

વડોદરામાં મેમુ ટ્રેનનાં 3 ડબ્બામાં આગ લાગી: મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ

ગુરૂવારે વડોદરા રેલવે યાર્ડમાં મેમુની મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુના 3 ખાલી ડબ્બામાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે ત્રણેય ડબ્બાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.

આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા રેલવે સ્ટાફ-ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધીમાં 3 બોગીઓ બળીને ખાખ થઈ

ગઈ હતી. આગ લાગવાનું કારણ કેબલ ટ્રિપ થતાં આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઈ સમાચાર મળ્યાં નથી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી, અને આગની ઘટના વખતે તે યાર્ડમાં બંધ હાલતમાં હતી.

ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયરબ્રિગેડને કરાતા કાફલો પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરાની સિવિલમાં જ રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચવાનું કૌભાંડ

વડોદરા

વડોદરાની ગોત્રી સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનો બ્લેકમાં વેચવામાં આવી રહ્યા હોવાની વિગતોના પગલે પોલીસે છટકું ગોઠવી ઓક્સિજન પ્લાન્ટ ના ઓપરેટરને ઇન્જેક્શન બ્લેકમાં વેચતા ઝડપી પાડ્યો છે.

કોરોના ના દર્દીઓની મજબુરીનો લાભ લઈ ઇન્જેક્શન તેમજ મેડિકલ સાધનો ના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. વડોદરામાં થોડા સમય પહેલાં જ ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. જ્યારે ત્યાર પહેલા પણ રેમડેસિવિર ઇન્જેક્શન ઓને બ્લેકમાં વસ્તી એક ગેંગ પકડાઈ હતી.

વડોદરાની સૌથી મોટી સરકારી કોવિડ હોસ્પિટલ મા ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનો ને કેટલાક કમ્પાઈનીઓ બ્લેકમાં વેચી રહ્યા હોવાની વિગતો મળતાં કાર્ડમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજા એ છટકું ગોઠવવા સ્ટાફને

સૂચના આપી હતી.

જે મુજબ કાર્ડમ બ્રાન્ચની ટીમે ગઈકાલે રાત્રે ગોત્રી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા સોહીલ સિરાજ ભાઈ દરબાર (રહે સરવૈયા નગર,ઈએસાઈ હોસ્પિટલ પાસે,ગોત્રી) પાસે એક ડબ્બા ગ્રાહક મોકલ્યો હતો. સિરાજે એક ઇન્જેક્શન માટે રૂ 15000 નો ભાવ કહેતા ગ્રાહકે ઇન્જેક્શન બરીદવાની તૈયારી બતાવી હતી. ઓપરેટર સિરાજે ઇન્જેક્શન લાવી આપતા બોગસ ગ્રાહકે પોલીસ ને ઈશારો કરી જાણ કરી હતી. જેથી પોલીસે સિરાજ ને ઝડપી પાડી ઇન્જેક્શન અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસની પૂછપરછમાં આ ઇન્જેક્શન ગોત્રી મેડિકલ કોલેજમાં સર્વન્ટ તરીકે કામ કરતા શૈલેષ ઉર્ફે રવિ કાળીદાસ પ્રજાપતિ (રહે સરવૈયા નગર એસ આઈ હોસ્પિટલ પાસે ગોત્રી રોડ) પાસે થી રૂ 14,000 માં મેળવ્યું હોવાનું કબુલતા પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે.



First Flight
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$5 11 LB \$50 વધુ દર LB ના \$5 23 KG \$165, વધુ દર KG ના \$10 30 KG \$210, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
<p>જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ચાર શાખાઓ</p>	
<p>બ્રામ્પટન (વેસ્ટ) ૫૧૯, રે લોસન બુલેવર્ડ યુનિટ-૩ બ્રામ્પટન ON L6Y 0N2 ટે. 647-761-1317, 647-657-9631 ચાંદનીચોક પ્લાઝા સબ્જી મંડીની સામે સોમ-શુક્ર ૨.૦૦ PM થી ૬.૦૦ PM શનિ-રવિ : ૧૧.૦૦ AM થી ૬.૦૦ PM</p>	<p>India import Services Available બ્રામ્પટન (વેસ્ટ) : 647-657-9631, 647-761-1317 સ્કારબોરો : 416-619-0352, મીસીસાગા : 905-673-9631</p>
<p>સ્કારબોરો WE ARE RE-OPENING ૮૮૦ મારખમરોડ, યુનિટ ૮ મેઈન ઈન્ટરસેક્શન મારખમરોડ & પેઈન્ટેડ પોસ્ટ સાંઈલીલા ખમણ-ટોકલા હાઉસ કોમ્પ્લેક્સ પાસે. ટે. 647-657-9631 / 905 673 9631 સોમ-બુધ : ૨.૦૦ PM થી ૬.૦૦ PM ગુરૂ-શુક્ર : વીક ઓફ શનિ-રવિ : ૧૧.૦૦ AM થી ૬.૦૦ PM</p>	<p>મીસીસાગા 2960 ફ્રુટ રોડ, યુનિટ-૧૫૮, મીસીસાગા ON L4T 0A5 ટે. 905-673-9631, 905-231-0527, 647-657-9631 ગ્રેટ પંજાબ પ્લાઝા, માલ્ટન, ગુરુદાસ પાસે સોમ-શુક્ર : ૧૧.૦૦ AM થી ૫.૦૦ PM શનિ-રવિ : વીક ઓફ</p>
<p>૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com</p>	



જેકવેલિનનું હોલીવુડ ડેબ્યુ

બોલીવુડ અભિનેત્રી જેકવેલિન ફર્નાન્ડીસ હોલીવુડની વેબ સીરીઝમાં ઈન્સ્પેક્ટરનું પાત્ર ભજવવા જઈ રહી છે. આ સાથે જ તે હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જેકવેલિન આ ફિલ્મમાં મહિલા પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળવાની છે. આ એક વુમેન સીરીઝ હશે જે છ વાર્તા પર આધારિત હશે. આ સીરીઝના લીડ રોલમાં ફક્ત અભિનેત્રીઓ જ જોવા મળશે. જેકવેલિને સીએસટી પોલીસ સ્ટેશનમાં પણ આ સીરીઝના થોડા દ્રશ્યોનું શૂટિંગ કર્યું છે. જેકવેલિન સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે નિયમિત રીતે પોતાના વિશે પોસ્ટ અને તસવીર પ્રશંસકો સાથે શેર કરતી રહે છે.



ઓટીટી એટલે મનોરંજન જગતના માથે વધારાનું ઢોગું

પ્રિયંકા ચોપરા જોનાસ સમય સાથે ચાલવા માટે પંકાયેલી છે. તે કાંઈપણ નવું શીખવા કે કરવામાં પાછળ નથી પડતી. બલ્કે નવીનતાને આવકારે છે. આ કારણે જ તેના હાથમાંથી કોઈ તક સરકી નથી જતી. તે 'ઈઝન્ટ ઇટ રોમાંટિક' (૨૦૧૯), 'વી કેન બી હીરોઝ' (૨૦૧૯) અને તાજેતરમાં રજૂ થયેલી 'વ્હાઈટ ટાઈગર'નો ભાગ બની. ઓટીટી પ્લેટફોર્મ વિશે પ્રિયંકા માનવું છે કે મનોરંજન જગતમાં આ માધ્યમ મહત્વનું સ્થાન મેળવી રહ્યું છે. લોકો મૂવી થિયેટર્સ અને ઓટીટી પ્લેટફોર્મની તુલના કરે છે ત્યારે તેને આશ્ચર્ય થાય છે. તેમને તેના વિશે વાત કરતાં સાંભળીને મને એવું લાગે છે જાણે આપણે આગળ વધતાં ગભરાઈએ છીએ. જ્યારે તેનું માનવું છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તમને બિઝનેસની વધારાની તક આપે છે. જ્યાં સુધી સેટેલાઈટ ચેનલોનું આગમન નહોતું થયું ત્યાં સુધી ફિલ્મો માત્ર સિનેમાગૃહોમાં જ રજૂ થતી હતી. પરંતુ સેટેલાઈટ ચેનલો આવ્યા પછી થિયેટરમાં રજૂ થયેલી મૂવીઝ પણ ટી.વી. પર રજૂ કરવાની તક મળી. આને આપણે બિઝનેસનો વિકાસ જ કહી શકીએ. પ્રિયંકા સ્વયં તેના પતિ નિક જોનાસ સાથે મળીને ઓટીટી કન્ટેન્ટ ડેવલપ કરી રહી છે. તે કહે છે કે ઓટીટી મનોરંજન જગતના માથે લાગેલું વધારાનું ઢોગું છે. તેથી તેનાથી ડરવાને બદલે આપણે તેનો ઉપયોગ આપણી તરફેણમાં કરવો જોઈએ. એ વાતમાં બે મત નથી કે દર્શકોને થિયેટરમાં જઈને પોપકોર્ન ખાતાં ખાતાં મૂવીની મજા માણવાની ખોટ સાલી રહી છે. પરંતુ હાલના તબક્કે તેનો કોઈ વિકલ્પ નથી. આપણે એમ માનીને ચાલવું જોઈએ કે આપણને હમણાં અજાણ્યા લોકો સાથે નહીં, બલ્કે પરિવારજનો સાથે બેસીને ઘરમાં જ મનોરંજન માણવાની તક મળી છે. વળી આ પ્લેટફોર્મ પર આપણે ગમે તે સમયે ફિલ્મો, સિરિઝો ઇત્યાદિ જોઈ શકીએ છીએ. તે ઉમેરે છે કે મારા મતે ઓટીટી અને થિયેટરો એકસાથે ચાલે છે. અને તેને કારણે આપણને વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મો અને સિરિઝો બનાવવાનો મોકો મળે છે.



કાલે શું થશે તે કહેવું કઠિન છે: પૂજા હેગડે

ગયા વર્ષે લોકડાઉનમાંથી થોડી રાહત આપવામાં આવતાં જ ફિલ્મોના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. આ સમય દરમિયાન અભિનેત્રી પૂજા હેગડે પણ પોતાની છ ફિલ્મોના શૂટિંગ કરવા મચી પડી હતી. તેણે પ્રભાસ સાથેની 'રાધે શ્યામ'નું શૂટિંગ પૂરું કર્યું અને 'સર્કસ' સહિત અન્ય હિન્દી, તમિળ, તેલુગુ ફિલ્મોના શૂટિંગ શરૂ કર્યાં. જેકે પોતાના કામમાં ગળાડૂબ પૂજાને કોવિડ-૧૯ના હળવા લક્ષણો જણાતા તે ઘરમાં ક્વોરન્ટિન થઈ ગઈ અને તબીબોની સૂચના મુજબ દવાઓ લેતી રહી. તેના પરિવારજનોએ તેની સારી રીતે કાળજી લીધી. પૂજાએ પણ ભરપૂર આરામ કરીને અને સ્વાસ્થ્યપ્રદ આહાર લઈને કોરોનામાંથી ઝટ ઊભા થવાના પ્રયાસો આદરી દીધાં. એક કલાકાર તરીકે મને આ વાત આનંદ આપે છે. મારી ઘણી ફિલ્મો રજૂઆત માટે તૈયાર છે. હું ઇચ્છું છું કે મહામારીનો સમય ઝટ વિતી જાય. આ મહાવ્યાધિ જલદી અંકુશમાં આવી જાય તો લોકો ફરીથી સિનેમાગૃહોમાં જઈને ફિલ્મો જોવાની મોજ માણી શકે. બાકી હાલના તબક્કે બધું અચોક્કસ છે. કાલે શું થશે તે કહેવું કઠિન છે.



PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ



Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time





GRAND CENTRAL MIMICO
(South Tower)

Guaranteed Access
to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,

Starting from **\$500's**



Nadir Shah MBA
Sales Representative

416.625.3580
nadir.shah@sympatico.ca

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

4030, Sheppard Ave. East, Toronto,
ON M1S 1S6 T: 416.291.0929 (24/7)
F: 416.291.0984



Not Intended to solicit buyers or sellers already under a contract.



॥ સંસ્કૃતિ ॥

હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



કોરોના વાઈરસના ફેલાવા અંગે નિષ્પક્ષ તપાસ કરવા વિશ્વના વૈજ્ઞાનિકોની માંગણી

કોરોનાની ઉત્પત્તિ અંગેના સંશયો હજી અકબંધ

વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમે સાર્સ કોવિડ-૧૯ વાઈરસ વુહાનની લેબોરેટરીમાંથી ફેલાયો હોવાની શક્યતા નકારી કાઢી હતી. પરંતુ ચીનની મેલી મથરાવટીને જોતાં હજી પણ વૈજ્ઞાનિકોને શંકા છે તેથી તે દિશામાં વ્યવસ્થિત તપાસ થવી જરૂરી છે. 15 મહિનાથી દુનિયામાં તબાહી મચાવી રહેલો કોરોના વાઈરસ અચાનક ક્યાંથી આવ્યો એ રહસ્ય ઉપરથી હજી પણ પડદો ઉચકાયો નથી. છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી કરોડો લોકોને સંક્રમિત કરનારા સાર્સ કોવિડ-૨ નામના આ વાઈરસનું પગેરું ખુદ વૈજ્ઞાનિકો મેળવી શક્યા નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાઈરસ કેવી રીતે ફેલાયો એનો અભ્યાસ કરવા ટીમની રચના કરી હતી. આ ટીમ કોરોનાના કથિત ઉદભવ સ્થાન ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં પણ ગઈ હતી. પરંતુ તપાસમાં કશું હાથ લાગ્યું ન હતું. હવે દુનિયાભરના કેટલાંક વૈજ્ઞાનિકો મળીને કોરોના વાઈરસની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની વ્યવસ્થિત તપાસ કરવા માંગ કરી રહ્યાં છે.

2019ના નવેમ્બરમાં ચીનમાં આ વાયરસનો પ્રથમ કેસ દેખાયો હતો. શરૂઆતમાં એવી અટકળો ચાલી હતી કે, કોરોના વાઈરસ વુહાનના એક એવા બજારમાંથી ફેલાયો હતો જ્યાં સી ફૂડની સાથે સાથે વન્ય પ્રાણીઓનું માંસ પણ વેચાતું હતું. આ બજારમાં ચામાચિડીયા પણ વેચાતા હતાં જેમાંથી આ વાઈરસનું સંક્રમણ હોવાનું જણાયું હતું. ત્યારબાદ પશ્ચિમી દેશોના મીડિયામાં રિપોર્ટ આવ્યાં કે કોવિડ-૧૯ નામનો રોગ ફેલાવતો આ સાર્સ કોવિડ-૨ નામનો વાઈરસ વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરોલોજીમાંથી લીક થયો છે.

એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં કામ કરતી એક ઈન્ટર્ન દ્વારા કોરોના વાઈરસ ભૂલથી લીક થઈ ગયો હતો. આ રિપોર્ટ અનુસાર આ વાઈરસ લોકોમાં ફેલાયો એ પહેલા આ યુવતી સુરક્ષાના નિયમોનું પાલન કર્યું ન હતું. તેને કારણે વાઈરસથી સંક્રમિત થઈ ગઈ હતી.

વાઈરસ વુહાનના માંસબજાર સુધી કેવી રીતે પહોંચ્યો એ અંગે એક થિયરી વુહાન ઈન્સ્ટીટ્યૂટના પ્રોફેસર શી ઝેંગલીએ પણ આપી હતી. શીના જણાવ્યા અનુસાર ચામાચિડીયાના સેમ્પલ લેવા માટે તેઓ ચીનના જુદાં જુદાં વિસ્તારોમાં ફર્યા અને લગભગ ૨૮ જેટલી ગુફાઓમાં જઈને તેમણે ચામાચિડીયાના મળના સેમ્પલ એકઠા કર્યાં. બાદમાં એ સેમ્પલના આધારે ચામાચિડીયામાં જોવા મળતા વાઈરસોનો એક આખો આર્કાઈવ તૈયાર કરવામાં આવ્યો. આ આર્કાઈવમાં નવતર



કોરોના વાઈરસનો પણ ઉલ્લેખ હતો. આ વાઈરસ હોર્સશૂ બેટ નામની ચામાચિડીયાની પ્રજાતિમાં જોવા મળ્યો હતો. જો કે, આજે પણ વિજ્ઞાનીઓને વાયરસનું ઉદભવ સ્થાન ક્યા છે તે જાણવામાં જ રસ છે. આ વિશે 'ધ વાયર'ના સાયન્સ પોર્ટલ રોના ઉપર બ્રિટિશ પત્રકાર નિકોલસ વેડે સવિસ્તાર અહેવાલ ટાંક્યો છે. તેઓ પાલ 'નેચર' અને 'સાયન્સ' જેવાં પ્રતિષ્ઠિત મેગેઝિનમાં લેખક છે. કોરોનાની પૂર્વ ભૂમિકા બાંધતાં નિકોલસ લખે છે કે, ડિસેમ્બર, 2019માં મહામારી પ્રસરી ત્યારે ચીનમાં વુહાનનાં સી ફૂડ માર્કેટ આસપાસ કોરોનાના કેસ દેખાયા હતા. કોરોના પ્રસાર્યો ત્યારે નિષ્ણાતોએ 2002માં પ્રસરેલાં 'સાર્સ-1' જેવી જ સ્થિતિ અનુભવી હતી.

**પ્રાસંગિક
ધવલ શુક્લ**

કોરોનાને કુદરતી વાયરસ ગણવા મુદ્દે લેખકો અને વૈજ્ઞાનિકો બે જૂથમાં વહેંચાયા, કેટલાકને મતે માનવસર્જિત વાયરસ ટેકનિશિયનની ભૂલને કારણે જ લીકેજ થઈ ગયો

'સાર્સ-1' બિલાડાની એક જાતિમાંથી માણસોમાં પ્રસાર્યો હતો. એ જ રીતે 2012માં 'માર્સ' પ્રસાર્યો હતો. 'માર્સ' વિવિધ દેશોમાં પ્રસાર્યો તેમાં હોસ્ટિંગ પ્રાણી તરીકે ઊંટને ગણવામાં આવ્યાં હતા. 'સાર્સ' અને 'માર્સ' મૂળે કોરોના વાઈરસના જ ભાગ છે. અગાઉના અનુભવથી તત્કાલ એવું તારણ નીકળ્યું હતું કે, 'સાર્સ' અને 'માર્સ'ની જેમ કોરોના પણ

કુદરતી રીતે પ્રાણીઓ દ્વારા માણસોમાં પ્રવેશ્યો છે. જો કે, ચીનના સંશોધકોના મતે કોરોનાના પહેલા તબક્કે નોંધાયેલા કેસોને માંસ માર્કેટ સાથે કોઈ સંબંધ નહોતો. જેથી માંસ માર્કેટમાંથી કોરોના નથી આવ્યો તો પછી તેનું જન્મસ્થાન વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરોલોજી હોવું જોઈએ, તેવી શક્યતા તરફ તપાસ થતી રહી છે. આ અર્થે વાઈરોલોજિસ્ટ 'ઈકોહેલ્થ' નામના આંતરરાષ્ટ્રીય જૂથે લેખમાંથી વાઈરસ આવ્યો છે તે થિયરીનો વિરોધ કર્યો અને તેનું જન્મસ્થાન જંગલી પ્રાણીઓ જ હોવાનો દાવો કર્યો છે. આ દાવા સામે લેખકોના એક જૂથની દલીલ એવી છે કે, વાઈરસ લેખમાંથી આવ્યો છે, પછી ભલે તેમાં કાવતરું ન હોય. વિજ્ઞાનના પ્રતિષ્ઠિત મેગેઝિન 'લેન્સેટ'માં બંને

તેનું બંધારણ બન્યું છે, તેના ઉપરથી આ પ્રકારના વાઈરસનું નિર્માણ કરવું અશક્ય જણાય છે.

આ વાયરસના સ્વરૂપો માણસના શરીરને ભેદે છે. જો કે તેની સામે લેખકોના જૂથની દલીલ એવી હતી કે, જ્યારે લેખમાં કોઈ વાઈરસ બનાવાય છે ત્યારે તેની કોઈ એક રીત નથી હોતી. તે અનેક રીતે બની શકે છે. એટલે તેના સ્વરૂપો પણ જુદા જુદા હોઈ શકે છે. જો કે, વિજ્ઞાનીઓએ આ દલીલને નકારી દીધી છે. લેખકો અને વિજ્ઞાનીઓના આ જૂથમાં બે ચહેરા વિશેષ જણાયા છે. તેમાં અમેરિકા સ્થિત વાઈરોલોજિસ્ટ ડૉ. ડઝાક પણ સામેલ છે. તેઓ કોરીના વાઈરસના સંશોધન માટે વુહાનની જ લેબને ભંડોળ આપતા રહ્યા છે. જ્યારે બીજા વાઈરોલોજિસ્ટનું નામ ક્રિસ્ટીઅન એન્ડરસન છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન'નું મિશન ચીનમાં તપાસ અર્થ ગયું હતું તેમાં એક સભ્ય ડૉ. ડઝાક હતા, જે અગાઉથી જ એવું માનતા હતા કે, લેખમાંથી વાઈરસ આવ્યો નથી. આ કિસ્સામાં વુહાનની લેબોરેટરીમાં જે હદે કોરોના વાઈરસના અલગ અલગ ભાત પર અભ્યાસ થયો ત્યારે તેનું જોખમ મોટું હતું.

મહામારી પ્રસરી તેના પહેલાંની ડઝાકે મુલાકાતમાં કહ્યું હતું કે, વુહાન લેબના સંશોધકો કોરોના વાઈરસના 1 સ્પાઈક પ્રોટીનના માળખાને એ રીતે ફરી કાર્યરત કરી રહ્યાં છે કે તેનાથી વાઈરસ માનવ જેવું બંધારણ ધરાવતાં ઉદરમાં પ્રવેશી શકે અને જો આ રીતે સાત વર્ષ સુધી કામ ચાલતું રહ્યું તો 'સાર્સ' સંબંધિત 100 જેટલાં નવા કોરોના વાઈરસ શોધી શકાશે. આમાંથી કેટલાંક વાઈરસને લેખમાંથી માણસમાં પ્રવેશતાં કરી શકાય અને તે એવા પ્રકારની બીમારી બને કે તેની કોઈ વેક્સિન પણ ન બનાવી શકે. ડૉ. ડઝાકે વધુમાં કહ્યું હતું કે, કોરોના વાઈરસમાં લેખમાં ખૂબ સરળતાથી ફેરફાર કરી શકાય. આ રીતે ડૉ. ડઝાકના નિવેદનની નોંધ લેવાય તો આ મામલે સત્યને તેમના કરતાં અન્ય કોઈ સારી રીતે જાણતું નહીં હોય તેમ માની શકાય છે. બીજી તરફ ઈટિહાસમાં 1960-70ના દાયકામાં ત્રણ વાર સ્મોલપોક્સ વાઈરસ આ રીતે લેખમાંથી લોકોને સંક્રમિત કરી ચૂક્યો હોવાના દાખલા છે. વધુમાં એક ફિઝિશિયન, રિસર્ચર સ્ટીવને દાવો કર્યો છે કે, વુહાનમાં પહેલાવહેલા આવેલા કોરોનાના દર્દીને જે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે હોસ્પિટલ વુહાનની સબવે લાઈન પર આવેલી છે. તેના એક છેડે વુહાનની વાઈરોલોજિસ્ટ લેબ અને બીજા છેડે ઈન્ટરનેશનલ એરપોર્ટ હતું. એટલે આ વાઈરસ દુનિયાભરમાં પ્રસારે તે માટેનું આગોતરું આયોજન હોવાની શંકાને પણ બળ મળે તેમ છે.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

GOOD NEWS FOR RECENTLY GRADUATED STUDENTS INSIDE CANADA

**STUDENTS UNDER POST GRADUATION WORK
PERMIT WITH IELTS 5 BAND CAN QUALIFIED
TO APPLY FOR PERMANENT RESIDENCY
RIGHT AWAY !!**

Effective May 6, 2021, Immigration, Refugees and Citizenship Canada (IRCC) will begin accepting applications under the following 3 streams:

20,000
applications
for temporary
workers in
health care

30,000
applications for
temporary
workers in other
selected essential
occupations

40,000
applications for
international
students who
graduated from a
Canadian
institution

**FIRST COME FIRST
SERVE BASIS !!**

CONTACT US IMMEDIATELY

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466
905-230-7855**

2/A WAGHESHWARI SOC,
VADODARA GUJARAT INDIA

**91-9428973911
91-9512157817**

Email.: info@siis.ca

Website.: www.siis.ca



AMI MEHTA
IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTED
CASES WELCOME**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**



શું તમે પણ બ્લેક હેડ્સની સમસ્યાથી કંટાળી ગયા છો, કરો દેશી સારવાર

ધૂળ-માટીના કારણે સુંદરતાથી સંબંધિત કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. બ્લેકહેડ્સ પણ તેમાંથી એક છે. ખાસ કરીને લોકોને બ્લેકહેડ્સ નાક પર જ થાય છે. જે ચહેરાની સુંદરતા પર ડાઘ સમાન છે. તો તમે આ સુંદરતાને પરત મેળવવા માટે લોકો કેટલાક ઉપાય કરે છે. પરંતુ કોઈ ફાયદો થતો નથી. એવામાં તમે કેટલાક ઘરેલું ઉપાય કરીને બ્લેકહેડ્સ દૂર કરી શકાય છે. તો આવો જોઈએ કેવી રીતે બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.

બેકિંગ સોડા

એક બાઉલમાં બે ચમચી બેકિંગ સોડા લઈને તેમાં પાણી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવી લો. થોડીક મિનિટ માટે સૂકાવા દો. હવે આ પેસ્ટ સૂકાઈ જાય તે પછી ઠંડા પાણીથી તેને ધોઈ લો. થોડાક દિવસ સુધી આમ કરવાથી બ્લેકહેડ્સ દૂર થઈ જાય છે.

લીંબુનો રસ

લીંબુનો સ્ક્રબ લગાવવાથી બ્લેકહેડ્સ દૂર થઈ જાય છે. એક બાઉલમાં મધ, દહીં, મીઠું, ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. જ્યારે તે સૂકાઈ જાય તે પછી ચહેરાને ધોઈ લો. જેને અઠવાડિયામાં બે વખત લગાવવાથી ખૂબ ફાયદો મળે છે.



સ્ટીમ

બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે સ્ટીમ લો. સ્ટીમ લેવાથી ત્વચા મુલાયમ થઈ જાય છે. તે પછી બ્લેકહેડ્સને દબાવીને સ્કિનમાંથી બહાર નીકાળી લો. જ્યારે બ્લેકહેડ્સ નીકળી જાય તો ચહેરાને ટુવાલથી સાફ કરી લો.

આકર્ષક દેખાવા માટે ટ્રાય કરો કમ્ફર્ટેબલ, સ્ટાઇલિશ, ટ્રેન્ડી જમ્પસૂટ

આપણે રોજિંદા જીવનમાં પહેરી શકાય એવાં કેટલાંય વસ્ત્રો વિશે વાત કરીએ છીએ, આજે આપણે કોટન ટ્રેન્ડી જમ્પસૂટ વિશે વાત કરવાની છે. કોટન મટીરિયલમાંથી બનેલાં જમ્પસૂટ પહેરવાની ખૂબ મજા આવે છે. આ સિઝનમાં બને ત્યાં સુધી લૂઝ જમ્પસૂટ બનાવડાવવા જેથી પહેરાતાં તે કમ્ફર્ટેબલ બની રહે. ઊભી લાઈનિંગવાળા લિનનના કાપડમાંથી બનેલા આ જમ્પસૂટને તમે ઓફિસવેર તરીકે ઉપયોગમાં લઈ શકશો. ઓફ શોલ્ડર અને ગાઉન જેવા દેખાતાં જમ્પસૂટ પાર્ટીવેર તરીકે ખૂબ સુંદર લાગશે. જો તમે સ્કિની જમ્પસૂટ પહેરવાની ઈચ્છા રાખતા હોવ તો બ્લેક નેટમાંથી બનેલો સ્કિન જમ્પસૂટ પણ તમે ટ્રાય કરી શકો છો. જો બ્લેક કલર



જો તમે સ્કિની જમ્પસૂટ પહેરવાની ઈચ્છા રાખતા હોવ તો બ્લેક નેટમાંથી બનેલો સ્કિન જમ્પસૂટ પણ તમે ટ્રાય કરી શકો છો.

ન પહેરવો હોય તો તેના ઓપ્શનમાં ડાર્ક મરુન કે બ્લૂ કલરની પસંદગી કરી શકાય. અલબત્ત જેને ડાર્ક કલર નથી ગમતા તેઓ પેસ્ટલ અને લાઈટ કલર જેમ કે, ન્યૂડ કલર, પિસ્તા કલર, લાઈટ પિન્ક, બેબી પિન્ક, પરપલ, સ્કાય બ્લૂ વગેરે કલરની પણ પસંદગી કરી શકશે. નેટ અને સ્કિન જમ્પસૂટ આ તમામ કલરમાં સુંદર લાગશે. એ સિવાય અહીં સંગીત કે નાના પ્રસંગમાં પહેરવા માટે સિલ્કના જમ્પસૂટનો ફોટો પણ આપવામાં આવ્યો છે. આજકાલ છોકરીઓ નાના નાના પ્રસંગોમાં આ પ્રકારનાં જમ્પસૂટ સાથે ટ્રેન્ડી જવેલરી પહેરવાનું ખાસ પસંદ કરતી હોય છે. ખાસ કરીને ટીનેજ ગર્લ્સને પ્રસંગોમાં સિલ્ક જમ્પસૂટ પહેરાતાં ખૂબ જ સુંદર લાગશે. પહેલાં જમ્પસૂટ પેન્ટ સ્ટાઈલમાં જ આવતાં હતાં, હવે પ્લાઝો, સિગાર પેન્ટ, સ્કર્ટ વગેરે તમામ સ્ટાઈલમાં આવે છે.


વોટ્સએપ, ટેલીગ્રામ, સિગ્નલ બાદ ગૂગલની પણ પોતાની ચેટિંગ એપ

ગૂગલએ સૌપ્રથમ Google Hangouts ચેટિંગ એપ 2013માં લોન્ચ કરી હતી. ત્યારબાદ 2016માં Google Allo ચેટિંગ એપ લોન્ચ કરી હતી. પરંતુ માત્ર 3 વર્ષમાં જ આ એપની સર્વિસ બંધ કરી દીધી હતી.

Google Chat એ Google Hangouts નું જ રીબ્રાન્ડિંગ કરી નામ આપવામાં આવ્યું છે. જે આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. Google Chat એ Gmail સાથે એમ્બેડેડ (જોડાણ) છે જેથી યુઝર્સએ અલગથી કોઈ એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી. પરંતુ એન્ડ્રોઈડ યુઝર્સ માટે હજી Gmail એપમાં Google Chat એમ્બેડેડ કરવાનું બાકી છે. યુઝર્સ પ્લેસ્ટોર પરથી Google Chat એપ ડાઉનલોડ કરી તેનો વપરાશ કરી શકે છે. Google Chat માં તમે એકબીજાને મેસેજ કરી શકશો, Google Roomsની સેવાનો લાભ લઈ શકશો, ગૂગલના અન્ય ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકશો, ઈમેલ્સ, વિડીઓ તથા ડોક્યુમેન્ટ ફાઈલ પણ શેર કરી શકશો.

Gmail માં હવે Google Chat, Google Meet અને Google Rooms પણ શામેલ છે. હમણાં સુધી ગૂગલે ફક્ત તેના ગૂગલ વર્કસ્પેસ યુઝર્સને જ ચેટ એપ્લિકેશનનો લાભ લેવાની મંજૂરી આપી હતી. પરંતુ ફેબ્રુઆરી 2021માં આ ચેટિંગ એપ અન્ય યુઝર્સ પણ વપરાશ કરી શકે છે.

ગૂગલની અન્ય સર્વિસ જેવી કે વોઈસ કોલિંગ માટે Google Voice અથવા



Phone એપ, મેસેજની આપ-લે કરવા Messages, Google Calendar, Google Contacts, વિડીઓ કોલ માટે Google Duo, વિડીઓ કોન્ફરન્સ માટે Google Meet, ગ્રુપ ચેટિંગ માટે Google Rooms, ઈ-મેઈલ માટે Gmail, રૂપિયાની આપ-લે માટે Gpay, ફિટનેસ ટ્રેકર માટે Google Fit, ઓનલાઈન વિડીઓ જોવા YouTube, ઓનલાઈન સંગીત સંભાળવા YouTube Music, સમાચાર વાંચવા Google News વગેરે એપ્લિકેશન ઉપલબ્ધ છે. આ ઉપરાંત Microsoft Officeની જેમ ગૂગલની પોતાની ઓફિસ પણ છે જેમાં Google Docs, Google Sheets, Google Slides, Google Keep તથા Google Drive નો સમાવેશ થાય છે. ગૂગલ પર ફક્ત સર્ચ કરવાથી ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. આ રીતે ગૂગલ પોતાના યુઝર્સ માટે ઘણી સેવા ઉપલબ્ધ કરતું રહે છે અને યુઝર્સના વપરાશ મુજબ તેમાં ફેરફાર પણ કરતું રહે છે.

@beinghumanmj

DIVINE YOGA

By Geeta

FREE Special Yoga Class Streaming NOW
due to COVID

- Reduce Stress and Anxiety
- Boost Immunity and Sleep Quality
- Gain Strength and Flexibility
- Become the Best Version of Yourself

The beauty of yoga is that you don't have to be a yogi or yogini to reap the benefits

Join today on ZOOM!

Classes Available: One-to-One Individual, Therapeutic, and Children

GEETA TAILOR : 416-456-2261
Contact Geeta at divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

LIFE INSURANCE

MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$ 500,000		\$ 1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- ★ NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)
CANCER OR INSURANCE declined by other companies
- ★ CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- ★ MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits

Email : - Davindersingh1@gmail.com
www.financialhuttd.com

Davinder Singh Chawla

416.320.4614 Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

SUPER VISA INSURANCE

MONTHLY & ANNUAL PLANS
HARD TO BEAT OUR PREMIUMS



જહાજ સાથે ડૂબેલા વધુ 11ના મૃતદેહ મળ્યા : 49 લાપતા

વાવાઝોડાને કારણે મુંબઈ પાસે જહાજ દરિયામાં ફસાયું હતું, નૌકાદળ દ્વારા 261 લોકોમાંથી 188ને બચાવાયા

મુંબઈ
વિનાશક વાવાઝોડું તોફાનેનો ભોગ બનેલા અને દરિયામાં ડૂબી ગયેલા બાર્જ P30પને વાવાઝોડું આવવા અંગેની એક અદવાડિયા પહેલાં ચેતવણી આપવામાં આવી હતી. જો કે તેની અવગણના કરતાં તોફાને વાવાઝોડાએ અહીંયા વિનાશ વેર્યો હતો. આ દુર્ઘટનામાં ગુરુવારે વધુ ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બાર્જના કેપ્ટન સહિત ૪૯ લોકો હજી લાપતા છે જેની ભારતીય નૌકાદળ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ડૂબી ગયેલું બાર્જ પી૩૦૫ માટે કામ કરતા કામદારોને મદદ કરવાનું કામ કરતું હતું. તેમાં એન્જિન ન હતું. નૌકાદળ દ્વારા બાર્જ પર રહેલા ૨૬૧ લોકોમાંથી ૧૮૮ને બચાવવામાં આવ્યા હતા. એનસીપી નેતા નવાબ મલિકે માગણી કરી હતી કે દુર્ઘટના માટે જવાબદાર સામે પગલાં લેવા જોઈએ. કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય પણ જવાબદાર છે.



તોફાને વાવાઝોડાને લીધે મહારાષ્ટ્રમાં 11 લોકોનાં મોત

અરબી સમુદ્રમાં આવેલા તોફાને એટલે કે તાઉકિત વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં ભારે નુકસાન કરીને ગુજરાત તરફ ગયું છે. આ વાવાઝોડાથી મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારાના 6,૩49થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. આ વાવાઝોડામાં 11 જણના મોત થયા છે. જાનહાનિ થઈ છે એમાં ચાર જણ રાયગઢ, રત્નાગિરી અને થાણેમાં 2-2, સિંધુદુર્ગ અને દૂળેમાં 1-1- વ્યક્તિ મીરાચોડમાં એક અને મુંબઈમાં એકનો સમાવેશ થાય છે. મુંબઈના અરબી સમુદ્ર પર ત્રાટકેલા ટાઇટે વાવાઝોડાને લીધે વિવિધ જહાજ અને બાર્જ પર કામ કરતા સેંકડો લોકો અટવાઈ પડ્યા હતા.

બારાબંકીમાં વિવાદિત સ્થળે બુલડોઝર ફર્યું, વક્ફ બોર્ડે કાર્યવાહીને ખોટી ગણાવી

પોલીસે 39 નામજોગ, 150 અજ્ઞાત વિરુદ્ધ કેસ નોંધી લોકોને જેલમાં મોકલ્યા હતા

નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં રામસનેહીઘાટ પરિસરમાં બનેલા વિવાદિત સ્થળને પ્રશાસને લોકડાઉનમાં તોડી પાડીને તેનો કાટમાળ પણ ખસેડી લીધો છે. જિલ્લાધિકારીએ પોતાના નિવેદનમાં તે વિવાદિત સ્થળને ગેરકાયદેસર પરિસર ગણાવ્યું હતું. જો કે, સુત્રી વક્ફ બોર્ડ અને સમાજવાદી પાર્ટીએ પ્રશાસનની કાર્યવાહીને ખોટી ગણાવી છે. પ્રશાસને 17 મેના

રોજ વિવાદિત સ્થળને તોડી પાડીને તેનો કાટમાળ પણ ખસેડાવી લીધો ત્યાર બાદ રામસનેહીઘાટ ખાતેનું વિવાદિત સ્થળ ચર્ચામાં આવ્યું હતું. રામસનેહીઘાટના એસડીએમ દિવ્યાંશુ પટેલના સરકારી આવાસ સામે બનેલા વિવાદિત ધાર્મિક સ્થળ ખાતે રહેતા લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ ત્યાં રહેતા 3 લોકો આઈડી જમા કરાવ્યા વગર જ ફરાર થઈ ગયા હતા. બાદમાં એસડીએમએ

ધાર્મિક સ્થળના દરવાજાને હટાવી બાઉન્ડરી બનાવી તેને પોતાના કબજામાં લઈ લીધું હતું. તહસીલ પ્રશાસન દ્વારા ધાર્મિક સ્થળે રહેતા લોકોને નોટિસ મળી ત્યાર બાદ પક્ષકાર હાઈકોર્ટની શરણમાં પણ ગયા હતા. હાઈકોર્ટે 15 દિવસની અંદર પ્રશાસનને મસ્જિદ ખ્વાજા ગરીબ નવાજ અલ મંસૂરના ખાતાકીય પેપરો અને સુત્રી વક્ફ બોર્ડમાં નોંધણીનું પ્રમાણ જમા કરાવવા આદેશ આપ્યો હતો.

ટૂલકિટ કેસમાં રમણસિંહ અને સાંબિત પાત્રાની વિરુદ્ધ ફરિયાદ

નવી દિલ્હી
ટૂલકિટ કેસમાં ભાજપના આરોપો સામે પલટવાર કરીને કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તીસગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઈન થાણા ખાતે આ એફઆઈઆર નોંધાવી છે. હકીકતે કોરોના કાળમાં રાજકીય દળો વચ્ચે વાક્યુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ કોંગ્રેસ પર એવો આરોપ લગાવ્યો છે કે, તેમની એક

ટૂલકિટ દ્વારા મહામારીના આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીને બદનામ કરવાનું ધડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસે આ આરોપોને ખોટા ઠેરવ્યા છે અને સાંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. છત્તીસગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેના આધાર પર પોલીસે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં એઆઈસીસી, આઈટી રિસર્ચ સેલના લેટરહેડને બોગસ ગણાવીને તે અંગે ખોટી અને મનઘડત સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

એપ્રિલમાં ફુગાવો વધી 10.19% અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી

નવી દિલ્હી
એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક (હોલસેલ પ્રાઈસ) આધારિત ફુગાવો વધીને ૧૦.૪૯ ટકા થયો છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. ખાદ્યાન્ન વસ્તુઓ, કૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ ગુડ્સના ભાવ વધવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સળંગ ચોથા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. માર્ચ, ૨૦૨૧માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૭.૩૯ ટકા હતો. ગયા વર્ષે એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત

ફુગાવામાં ૧.૫૭ ટકાનો ઘટાડો થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ, મેન્યુફેક્ચરિંગ વસ્તુઓના ભાવ વધવાને કારણે એપ્રિલ, ૨૦૨૧માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો થયો છે. ઈંડા, માંસ અને માછલીના ભાવ વધવાને કારણે એપ્રિલમાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો વધીને ૪.૯૨ ટકા થયો છે. માર્ચ, ૨૦૨૧માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો ૩.૨૪ ટકા હતો. એપ્રિલ, ૨૦૨૧માં ઈંડા, માંસ અને માછલીના ભાવમાં ૧૦.૮૮ ટકાનો વધારો થયો છે.

પ્રયાગરાજમાં મૃતદેહોનો ઢગલો, ગંગા કિનારે લાશોની ગણતરી કરવી મુશ્કેલ

લખનઉ
ઉત્તરપ્રદેશમાં ગંગા નદીના કિનારે લાશોને દફનાવવાનો સિલસિલો યથાવત છે. ધાર્મિક મહત્વ ધરાવતા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં નદીના કિનારે લાશોનો અંબાર દેખાઈ રહ્યો છે. પ્રયાગરાજમાં રેતીમાં લાશોના અંતિમ સંસ્કાર કરાયા છે. અહિં સેંકડો લાશોને દફનાવવામાં આવી છે. યૂપીના ઉત્તરાવ જિલ્લામાં સેંકડો લાશોને રેતમાં દફનાવવાનો મામલો ઠંડો પડ્યો નથી ત્યાં જ પ્રયાગરાજ જિલ્લામાં જે દ્રશ્યો જોવા મળ્યા છે તે ભયાનક છે. પ્રયાગરાજના ફાક્મઉ વિસ્તારમાં ગંગાના કિનારે



ઘાટની સ્થિતિ એવી છે કે જ્યાં નજર જાય ત્યાં લાશો જોવા મળી રહી છે. લાશોને ગત એકથી બે મહિનાની અંદર જ અહિં દફનાવવામાં આવી છે. જો આ લાશોની ગણતરી કરવામાં આવે તો તેની સંખ્યા ખુબ જ વધારે થશે.

સરકારે મોકલેલા વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી : CM અશોક ગેહલોત

જયપુર : રાજસ્થાન અને કેન્દ્ર સરકાર વચ્ચે કોરોનાને લઈને આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી આ જંગ રાજકીય પણ બની રહ્યો છે. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોટે ફરી આરોપ લગાવ્યો છે કે, પીએમ કેર ફંડમાંથી મળેલા વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા એન્જિનિયરોની ટીમ પણ તેને રિપેર કરી શકી નથી. આ વેન્ટિલેટરનો ઉપયોગ લોકોના જીવન સાથે ચેડા કરવા જેવું છે. ખરાબ વેન્ટિલેટર સપ્લાય કરનારા સપ્લાયરો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે ધારાસભ્યોનું ફંડ વધારીને 5 કરોડ કરી નાંખ્યું છે.

2021માં ભારત રેન્સમવેરથી સૌથી વધુ પ્રભાવિત દેશ: ચેક પોઇન્ટ રિસર્ચ

મુંબઈ
અમેરિકામાં ગેસ પાઇપલાઇન કંપની રેન્સમવેરનો ભોગ બની હતી

નવો અહેવાલ સૂચવે છે કે ભારતમાં દરેક એકમ દર સમાહ કમસેકમ 213 રેન્સમવેર હુમલાનો સામનો કરે છે. આમ ભારત રેન્સમવેરના ભોગ બનનારા દેશોમાં ટોચના સ્થાને છે. ઈન્ટરનેટ પર સૌથી મોટી ડરામણું કે ભયજનક પાસુ હોય તો તે રેન્સમવેરનું હોઈ શકે છે. ચેક પોઇન્ટ રિસર્ચના નવો અહેવાલ સૂચવે છે કે વિશ્વસ્તરે 2020ની તુલનાએ 2021માં રેન્સમવેર હુમલામાં 102 ટકાનો વધારો થયો છે. તેના પગલે આંકડાઓ દર્શાવે છે કે

ભારત રેન્સમવેરથી સૌથી વધુ હુમલાઓનો ભોગ બનનાર દેશ છે. ભારતમાં પ્રતિ સંગઠન દીઠ સાપ્તાહિક ધોરણે 213 હુમલા થાય છે, જેમા વર્ષના પ્રારંભથી 17 ટકાનો વધારો થયો છે. રેન્સમવેર હુમલામાં ફોન અને બીજા ડિવાઈસીસ પર મેલવેર મોકલવાનો સમાવેશ થાય છે. તેના લીધે તમારા ડિવાઈસીસ અને સર્વરો પર અસર પડે છે. તેના માટે તમારે તમારા ડિવાઈસને લોક રાખવું પડે છે, જેથી તમારી ફાઇલ્સ અને ડેટા બીજા એક્સેસ ન કરી શકે.

PM સાથેની બેઠકમાં બોલવાની તક ન મળતાં મમતા બેનરજી અકબાયા

નવી દિલ્હી
નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના મહામારીને અંકુશમાં લાવવાને મુદ્દે ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના કલેક્ટર સાથે વચ્ચુંઅલ બેઠક કરી હતી. બેઠકમાં બંગાળના સીએમ મમતા બેનરજીએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં મમતા બેનરજીએ પત્રકાર પરિષદ બોલાવીને તેના ઘટનાક્રમ અંગે નારાજગી જાહેર કરી હતી. મમતાએ કહ્યું કે, 'બેઠકમાં ૧૦ રાજ્યોના મુખ્યપ્રધાન ભાગ લઈ રહ્યા હતા, પરંતુ કોઈને બોલવાની તક આપવામાં ના આવી. તો પછી મુખ્યપ્રધાનો જનતાની માગણીને વાચા કરઈ રીતે આપી શકે? અમે વેઠિયા મજૂર નથી. અમે મુખ્યપ્રધાનો અપમાનિત થયા હોવાનો અહેસાસ કરી રહ્યા છીએ.

લેબનોને ઈઝરાયેલ ઉપર રોકેટ છોડતા ફરી તંગદીલી

• ઈઝરાયેલ પર થયેલા હુમલાને લેબનોનમાં સક્રિય આતંકીઓ દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી તેલ અવીવ



ઈઝરાયેલના હવાઈ અત્યાર સુધી હુમલામાં ૨૧૩ પેલેસ્ટાઈનોનાં મોત

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો જંગ બીજા અઠવાડિયામાં ચરમસીમાએ પહોંચ્યો હતો. ગાઝા પટ્ટીમાંથી હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં ઈઝરાયેલમાં પેકેજિંગ પ્લાન્ટમાં કામ કરતા બે થાઈ મજૂરોનાં મોત થયા હતા. ૭ લોકોને ઈજા થઈ હતી. આ હુમલાના થોડા સમય પહેલા ઈઝરાયેલે કચેલા હવાઈ હુમલામાં પેલેસ્ટાઈનનાં એક ૬ માળની ઈમારત ઘસ્ટ થઈ ગઈ હતી. ૧૦ દિવસનાં જંગમાં પેલેસ્ટાઈનનાં ૨૧૩ નાગરિકોનાં મોત થયા હતા જેમાં ૬૧ બાળકો અને ૩૬ મહિલાઓ હતી. ૧૪૪૦ લોકો ઘવાયા હતા. પેલેસ્ટાઈનમાં જે ૬ માળની ઈમારત કુંકી મારવામાં આવી હતી તેમાં બૂક સ્ટોર્સ અને શિક્ષણ સંસ્થાઓ કામ કરતી હતી. હમાસનાં રોકેટ હુમલામાં ૧૨થી વધુ ઈઝરાયેલીનાં મોત થયા હતા જેમાં ૫ વર્ષનો બાળક અને સૈનિક તેમજ થાઈ મજૂરોનો સમાવેશ થાય છે.

પેલેસ્ટાઈનના સમર્થનમાં યુએસ, બ્રિટન સહિત અનેક દેશોમાં દેખાવો

ઈઝરાયેલ દ્વારા ગાઝા પર છેલ્લા સાત દિવસથી કરવામાં આવી રહેલા હવાઈહુમલા તેમજ બોમ્બમાર્યામાં નિર્દોષ પેલેસ્ટાઈનિયોનાં મોતનાં વિરોધમાં આખા વિશ્વમાં અમેરિકા અને બ્રિટન સહિત કેટલાક દેશોમાં હિસક દેખાવો કરવામાં આવ્યા હતા. ફ્રી પેલેસ્ટાઈનના નારા સાથે લોકોએ દેખાવો કર્યા હતા. ઈઝરાયેલને ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરવા લોકોએ લોંગ લીવ ઈન્ટીફાડાનાં સૂત્રો પોકાર્યા હતા. અમેરિકામાં લોસ એન્જલસ, ન્યૂયોર્ક, બોસ્ટન, સાનફ્રાન્સિસ્કો સહિત કેટલાક શહેરોમાં પેલેસ્ટાઈન તરફી લોકોએ જંગનો અંત લાવવાની માગણી કરી હતી. લોસ એન્જલસમાં ઈઝરાયેલનાં દૂતાવાસ સુધી બે માર્ચ લાંબી કૂચ યોજવામાં આવી હતી.

યુએઈ દ્વારા ઈઝરાયેલને શાંતિની અપીલ : OIC તેમજ UN ની બેઠક

યુએઈ દ્વારા પણ ઈઝરાયેલને શાંતિની અપીલ કરવામાં આવી છે. યુએઈનાં વિદેશ પ્રધાને સંઘર્ષ વિરામ કરીને શાંતિ જાળવવા ઈઝરાયેલ અને હમાસને અનુરોધ કર્યો છે. આ માટે યુએઈ દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલી સમજૂતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય સંબંધો સ્થાપવા કેટલાક આરબ દેશો દ્વારા અમેરિકાનાં નેતૃત્વમાં આ કરાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાઉદી અરેબિયાની પહેલ પછી ૫૭ મુસ્લિમ દેશો દ્વારા આ મામલે OICની બેઠક બોલાવાઈ છે. તે અમેરિકાનાં નેતૃત્વમાં યુએનની સુરક્ષા પરિષદની બેઠક પણ યોજાઈ છે. યુએનમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. ત્રિમૂર્તિએ જણાવ્યું હતું કે, સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ઈઝરાયેલનાં ફાઈટર્સ જેટના હમાસનાં ૬૫ સ્થળો ઉપર હુમલા

ઈઝરાયેલનાં ૬૦ જેટ ફાઈટર્સ દ્વારા હમાસ ઉગ્રવાદીઓનાં ૬૫ સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. કેટલાક રોકેટ લોન્ચર્સ છોડવામાં આવ્યા હતા. જેમાં ઉગ્રવાદીઓનાં ગ્રૂપ તેમજ હમાસ કમાન્ડર્સનાં મકાનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયેલનાં લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું કે સંભવતઃ સિરિયાથી છોડવામાં આવેલા માનવ રહિત વિમાન એટલે કે ડ્રોનને ઈઝરાયેલની બોર્ડર પર તોડી પાડવામાં આવ્યું હતું. હમાસ અને ઈસ્લામિક જેહાદીઓએ કહ્યું હતું કે તેમનાં ૨૦ સૈનિકો આ જંગમાં માર્યા ગયા છે જે કે ઈઝરાયેલે કહ્યું હતું કે તેણે ૧૬૦થી વધુ ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. તેણે ૨૪થી વધુ હમાસ કમાન્ડર્સનાં નામ અને ફોટા પણ જાહેર કર્યા હતા.

ઈસ્લામ ધર્મ અનુસાર શું માનવીનું તેના મૃત્યુ પછી ચક્ષુદાન કે તેના અન્ય અવયવોનું દાન કાયદેસર છે ?

ભાગ-૩

ઈસ્લામ ધર્મમાં એક માનવજીવનું મુલ્ય કેટલું અગત્યનું છે તે વિષેના કુરાન મજીદમાંના બોધવચનો આ પ્રમાણે છે :-
“જેણે કોઈ એક જીવને જીવન આપ્યું (એકનો જીવ બચાવ્યો), તો તેણે સમગ્ર માનવજાતને જીવન આપ્યું (સમગ્ર માનવજાતનો જીવ બચાવ્યો) એમ લેખાશે.” (પ્રકરણ ૫, શ્લોક ૩૨નો એક ભાગ)
“અને કોઈ જીવને, જેને મારવું અલ્લાહે ગેરકાયદેસર (હરામ) ઠેરવ્યું છે, તેને મારો નહિ, સિવાય કે કોઈ કાયદેસર ના કારણ (હક)ની સાથે.” (પ્રકરણ ૬, શ્લોક ૧૫૧ અને પ્રકરણ ૧૭, શ્લોક ૩૩)
કેવળ જરૂરતની ભૂમિકાએ જ અલ્લાહે ગેરકાયદેસર (હરામ) ઠેરવેલ ખાદ્ય વસ્તુ ઉપયોગમાં લઈ શકાય છે તે વિષેનું કુરાન મજીદમાંનું બોધવચન આ પ્રમાણે છે :-
“પછી જે વ્યક્તિ મજબુરીની અવસ્થામાં (અતિશય ભુખના કારણે, જીવ બચાવવા માટે) કોઈ વસ્તુ, જે અલ્લાહે ગેરકાયદેસર (હરામ) ઠેરવેલ છે, તે ખાવા માટે લાચાર થઈ જાય, પરંતુ અમારા આદેશનો અનાદર ન કરે, અને જરૂરતની મર્યાદા ન વટાવે (કેવળ જરૂરતની ભૂમિકાએ જ તેને છુટ છે) તો અવશ્ય તમારો પાલનહાર (રબ) ઘણો જ ક્ષમા કરનાર અને દયાળુ છે.” (પ્રકરણ ૬, શ્લોક ૧૪૫)
ઉપર આપેલા કુરાન મજીદમાંના પહેલા બે બોધવચનો અનુસાર પાલનહાર



મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના બોધવચનો પર આધારિત

અલ્લાહની દ્રષ્ટિમાં એક માનવ જીવની કેટલી અગત્યતા છે તે બહુ જ સારી રીતે સમજી શકાય છે કે એક માનવ જીવને બચાવવું એ સમસ્ત માનવજાતના જીવને બચાવવા સમાન છે. તે અનુસાર જો કોઈ મૃત્યુ પામેલો માનવી તેની લેખિત ઈચ્છા અનુસાર બીજા કોઈ જીવંત માનવીના જીવને બચાવવા માટે કે તેના ફાયદા માટે કે તેને સહાય કરવા માટે પોતાના શરીરના અવયવોનું દાન કરીને તે જીવંત માનવીને સહાય કરે છે તો તે અવશ્ય માનવજાતની સેવા સમાનજ લેખાશે, કારણ કે મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં માનવ જીવને બહુ જ મહત્વ આપવામાં આવેલ છે, એટલે સુધી કે બોધવચન ૨:૮૩ તથા

૨:૧૭૭માં દરિદ્રો તથા નિરાધારોની માનવસેવાને રાખેલા મુજબની સ્તુતિ (બંદગી) એટલે કે નમાઝ પર પ્રાથમિકતા આપવામાં આવેલ છે.
તે ઉપરાંત ઉપર આપેલા ત્રીજા ઈસ્લામની આરસી કાસિમ અબ્બાસ

પરવાનગી આપેલ છે. આ ખાદ્ય વસ્તુઓમાં મૃત જાનવરનું માંસ, લોહી, ડુક્કરનું માંસ વગેરેનો સમાવેશ થાય છે. આ પરવાનગીનું કારણ માનવ જીવની મહત્વતા તથા અગત્યતા છે.
માનવીના મૃત્યુ પછી તેની પોતાની ઈચ્છા અનુસાર તથા અમુક શરતોને આધિન તેના શરીરના અવયવોનું દાન માનવજાતના કલ્યાણ કાજે કાયદેસર હોવાના અસંખ્ય મુસ્લિમ ધર્મગુરૂઓના મંતવ્યો વિષે, જે આ લેખમાં આપવામાં આવેલ છે, અને જે પુસ્તક “ઈસ્લામી દ્રષ્ટિએ આંખોનું દાન”માં બતાવવામાં આવ્યા છે, તેનો સિધ્ધાંત તથા મુળભૂત પાયો ઉપર આપેલા કુરાન મજીદના ત્રણ

બોધવચનો તથા માનવજાતની સહાયને પ્રાથમિકતા આપતા અન્ય બોધવચનો જ છે. આ સર્વે બોધવચનોમાં માનવજીવને બચાવવા વિશે બહુ જ મહત્વ તથા અગત્યતા આપવામાં આવેલ છે.
ઈસ્લામ ધર્મ એક વ્યવહારિક અને વાસ્તવિક એટલે કે પ્રેક્ટીકલ ધર્મ હોવાના કારણે તેમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. માનવજાતના કલ્યાણ વિષેની તથા અન્ય એવી દરેક બાબતને પાલનહાર અલ્લાહના આદેશો, તેના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના અધિકૃત કથનો (હદીસો) તથા આજના સમયને અનુલક્ષીને સાચી અને સચોટ દલીલો, બુદ્ધિ અને તર્કશાસ્ત્ર (લોજિક) દ્વારા પરખવામાં આવે છે.
આ અનુસાર ઉપસંહારમાં એ જરૂર કહી શકાય કે કોઈ માનવી પોતાના જીવન દરમ્યાન માનવજાતના કલ્યાણ કાજે તથા અન્ય જીવંત માનવીને સહાય કરવા માટે અથવા તેનો જીવ બચાવવા માટે અથવા તેના અંધકારમય કે દુઃખી જીવનને સુધારવા માટે પોતાની લેખિત પરવાનગીથી પોતાના મૃત્યુ પછી, અમુક શરતોને આધિન, પોતાના શરીરના અવયવોનું દાન કરે છે, તો તે સદ્કાર્ય અસંખ્ય મુસ્લિમ ધર્મગુરૂઓના મંતવ્યો અનુસાર તથા પાલનહાર અલ્લાહના માનવજીવની અગત્યતા વિષેના આદેશો અનુસાર ઈસ્લામ ધર્મમાં કાયદેસર ગણવામાં આવેલ છે, જેનું અમલીકરણ અસંખ્ય ઈસ્લામી દેશો તથા ગેરઈસ્લામી દેશોમાં, કેનેડા સહિત થઈ રહ્યું છે.
સમાપ્ત

T20 વર્લ્ડ કપ માટે BCCIની 29મીએ મિટિંગ, કોવિડ-19નો મુદ્દો પણ ચર્ચાશે

નવીદિલ્હી

ભારતીય ક્રિકેટ બોર્ડનો આગામી લક્ષ્યાંક ઘરઆંગણે રમાનારા પ્રસ્તાવિત આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપનું સફળ આયોજન કરવાનો છે. આ માટે બીસીસીઆઈએ એક વિશેષ જનરલ મિટિંગ એટલે કે એજીએમની તૈયારી કરી લીધી છે જે ૨૯મી મેએ યોજાશે. આ એક વર્ચ્યુઅલ મિટિંગ રહેશે જે પહેલી જૂને યોજાનારી આઈસીસીની બેઠક પહેલાં યોજાશે.

બેઠકમાં મુખ્યત્વે ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ

વિમેન્સ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ રમશે

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ રવાના થશે જ્યાં તે વન-ડે અને ટી૨૦ સિરીઝ ઉપરાંત એક ટેસ્ટ મેચ પણ રમશે. આ પ્રવાસ પહેલાં મહિલા ક્રિકેટરને ખુશખબર મળ્યા છે. ભારતીય ટીમ સાટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડવાની છે અને તે કાંગારુ મહિલા ટીમ સામે પણ એક ટેસ્ટ મેચ રમશે. જોકે બીસીસીઆઈ અને ઓસ્ટ્રેલિયન બોર્ડ વન ઓફ ટેસ્ટ મેચની કોષ સત્તાવાર જાહેરાત કરી નથી. ભારતીય વિમેન્સ ટીમ છેલ્લે ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમી હતી.

કપ અંગે વાટાઘાટ થશે. બોર્ડના કપના આયોજનને ધ્યાનમાં રાખીને એક અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્પેશિયલ મિટિંગ ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ડીવિલિયર્સે નિવૃત્તિમાંથી પાછા ફરવાનો ઇનકાર કર્યો

બેંગલોર: પોતાની સ્કોટક બેટિંગ વડે સમર્થકોના દિલ જીતનાર મિસ્ટર ૩૬૦ ડિગ્રી એટલે કે એબી ડીવિલિયર્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા ફરવાનો ઇનકાર કરી દીધો છે. તેણે મંગળવારે સાઉથ આફ્રિકન બોર્ડને આ બાબતની માહિતી આપી દીધી હતી. આફ્રિકન બોર્ડે જણાવ્યું હતું કે ડીવિલિયર્સે સ્પષ્ટ શબ્દોમાં નિવૃત્તિમાંથી પાછા બહાર આવવાનો ઇનકાર કરી દીધો છે.

50 મીટર બેકસ્ટ્રોકમાં કોલેસનિકોવે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

બુડાપેસ્ટ ખાતે યોજાયેલી યુરોપિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં રશિયન સ્વિમર ક્લિમેન્ટ કોલેસનિકોવે સતત બીજા દિવસે ૫૦ મીટર બેકસ્ટ્રોકમાં પોતાના વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો હતો. ૨૦ વર્ષીય કોલેસનિકોવે ૨૩.૮૦ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

કમબેક મેચમાં જ સંઘર્ષ બાદ ફેડરરનો પરાજય

જિનેવા: સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરએ લગભગ બે મહિના બાદ ટેનિસ કોર્ટ ઉપર પુનરાગમન કર્યું હતું, પરંતુ તેને કમબેક મેચમાં જ પાવ્લો એન્ડ્રુજાર સામે જિનેવા ઓપન એટીપી ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં ૬-૪, ૪-૬, ૬-૪થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૨૦ના ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ક્લે કોર્ટ ઉપર પોતાનો પ્રથમ મુકાબલો રમાનાર ફેડરરે છેલ્લા ૧૫ મહિનામાં તેના જમણા ઘૂંટણમાં બે વખત સર્જરી કરાવી હતી.

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો ઉગ્ર વિરોધ, 6 હજાર ડોક્ટર્સ ઉતર્યા રસ્તા પર

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિ, જાપાન સરકાર અને આઈઓસી રમતોને સુરક્ષિત તથા સફળ બનાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રથમ સર્વેમાં જાપાનની જનતાના ઈનકાર બાદ વધુ એક વખત ટોચના પ્રોફેશનલ્સ આ રમતોને સુસાઈડ મિશન તરીકે ગણાવ્યા બાદ જાપાનના હજારો ડોક્ટર્સ ગેમ્સનો વિરોધ કર્યો છે. ટોક્યોના ડોક્ટર્સની એક નેશનલ સંસ્થાએ ઓલિમ્પિક રદ કરવાની માગણી કરી છે કારણ કે કોરોના વાઈરસના કારણે ડોક્ટર્સ ઉપર વધારાનું દબાણ લદાઈ ચૂક્યું છે.

કેનેડાનું પ્રતિનિધિત્વ કરતા અર્જનસિંહ ભુલ્લરે MMA વિશ્વ ટાઇટલ હાંસલ કર્યું

સિંગાપોર

શનિવારે બ્રેડન વેરાને હરાવીને સિંગાપોરની વન ચેમ્પિયનશિપમાં કેનેડાના અર્જનસિંહ ભુલ્લરે હેવીવેટ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સાથે જ અર્જનસિંહ આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ મૂળ ભારતીય પહેલવાન તરીકે પણ અંકિત થયા છે. જો કે મહિલા વર્ગમાં રિતુ ફોગાટને બીએનગ્યુએનના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેને પરિણામે રિતુની ખિતાબ હાંસલ કરવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. અર્જનસિંહ આ વિજય મેળવીને ફિલિપાઈન્સ મૂળના અમેરિકન વેરાના પાંચ વર્ષથી ચાલતા દબદબાને પણ ખતમ કર્યો છે. મળતી વિગતો મુજબ ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં અર્જને ગોલ્ડમેડલ મેળવીને તેમની પહેલવાનીનો પરિચય ભારતને આપ્યો હતો.

SHIV FINANCIAL SERVICES

Personal Tax - File is Free For New Immigrants.

Full Time Service Provider

Serving Community Since 2009

Supervisa Insurance Monthly Plan Available

- Life Insurance, Critical Illness Insurance & Mortgage Insurance with Money Back Option
- Health & Dental Plan
- Segregated Fund • Personal Tax-file

* અમે બધી ટોપની ઇન્સ્યુરન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. * New Life Insurance Advisors are recruited.

::: For Free Quotation & Consultation :::



જગદીશ સેવક
(Financial Advisor)
Cell: 647-236-7620

SHIV FINANCIAL SERVICES

"Proper insurance coverage is Peace of Mind"
Email: sevak_2007@hotmail.com
www.shivfinancialservices.ca

GUARANTEED LOWEST PREMIUM

MOTEL for SALE

NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com
Website: https://niraj-pancholi.c21.ca/

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence


<p style="color: red; font-weight: bold;">18 ROOM MOTEL WITH 3 BR HOUSE FOR OWNER NEAR PEMBROKE / 1.5 HRS FROM OTTAWA</p> <p>Almost 80% to 100% occupancy in 2019, 2020 & 2021, rooms are on high demand all rooms are given to long term customers on monthly basis. Easy one man operation, no housekeeping require. No competition, the only motel in town. The seller had spent over \$150K in room renovations and currently renovating his house. Low operating costs and high profit. Asking Price: \$925,000</p>	<p style="color: red; font-weight: bold;">SOME RECENTLY SOLD MOTELS</p> <ul style="list-style-type: none"> • Motel near Welland / St. Catherines SOLD • Motel near North Bay SOLD • Motel near London SOLD • Motel in Sarnia SOLD • Motel in Huntsville/ Muskoka SOLD • Motel near Cochrane, Hwy 11 SOLD <p style="font-size: 0.8em;">NEW LISTINGS COMING UP: NEAR COLLINGWOOD, GUELPH & NORTHERN ONTARIO</p>
<p style="color: red; font-weight: bold;">42 ROOM INDOOR CORRIDOR MOTEL NORTH OF TIMMINS</p> <p>Well maintained motel, located on Hwy 11 within the city, all amenities close by. Potential to convert it to franchise. Ideal property for the owner operator to run and grow the business. Asking Price: \$1,300,000</p>	<p style="color: red; font-weight: bold;">27 ROOM MOTEL NEAR THUNDER BAY AIRPORT</p> <p>Well maintained motel located on prime intersection and just 10 min from the airport. Year round operation and great net income + additional commercial rents from 2 tenants. About 40% down payment require. Asking Price: \$1,999,000</p>
<p style="color: red; font-weight: bold;">30+ ROOM MOTEL HWY 17, NEAR SAULT STE. MARIE</p> <p>Seller willing to hold mortgage. Asking Price: \$2,000,000</p>	<p style="color: red; font-weight: bold;">60 ROOM MOTEL IN THUNDER BAY, NEAR LAKE</p> <p>Multi stories, renovated rooms. Additional rental income from Restaurant & Sports Bar. Seller can hold mortgage at 40% down. Asking Price: \$2,000,000</p>
<p style="color: red; font-weight: bold;">QUALITY INN & SUITES ASKING \$4,500,000</p>	<p style="color: red; font-weight: bold;">JOB OR PARTNERSHIP OPPORTUNITIES</p> <ul style="list-style-type: none"> @ Experienced Motel Operator: to run the motel in northern Ontario, good pay. @ Working Partner: willing to invest minimum 10%. Partnership + Salary to run.

NOTE: Buyers to sign Representation Agreement on particular motels to get additional & financial information. About 40% down payment required to get a bank loan
Century 21 People's Choice Realty Inc., 120 Matheson Blvd E, Unit 103, Mississauga, L4Z 1X1 Office Ph: 905-366-8100,



રાજ્યમાં તૌકતેનું તોફાન : ભરઉનાળે માવઠું

તૌકતે વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતને ઘમરોળી નાખ્યું હતું. સતત બે દિવસ સુધી મૌસમે મિજાજ બદલ્યો અને ભરઉનાળે જોરદાર માવઠું કરોડો રૂપિયાની નુકસાનીનું કારણ બની ગયું છે. દક્ષિણ ગુજરાતથી છેક સૌરાષ્ટ્ર-કચ્છ સુધી ખાનાખરાબીના દ્રશ્યો સર્જાયા હતા. ક્યાંક ખેતી પાક, વીજ પોલી ધરાશાયી થયા હતા. આ ઉપરાંત દ્વારકામાં દરિયો તોફાને ચડતાં કિનારે લંગારેલી બોટ ઊંધી વળી ગઈ હતી. રાજ્યમાં મકાનો જમીન દોસ્ત થતા હજારો પરિવારો બેઘર થયા હતા. જ્યારે મોટા શહેરો અને ગામડાઓમાં હજારો વૃક્ષોએ તેનું અસ્તિત્વ ગુમાવ્યું છે.



Dr. Salim Kapadia DDS

Dental Centre

SK

Your Perfect
Smile...Is Our Greatest
Satisfaction!**SERVICES**

- Smile Makeover
- Laser Teeth Whitening
- Dental Implants - Start to Finish
- Single Visit Root Canal
- Re-treatment of Failing Root Canal
- Surgical Wisdom Teeth Extraction
- Scaling & Root Planing
- White Tooth Colored Filling
- Implant Retained Dentures
- Complete & Partial Dentures
- Lumineers & Veneers
- Crown & Bridges (Zirconia & E.max)

1825 Markham Rd, Suite 102
Scarborough, ON M1B 4Z9
drsalimkapadiadental.com

416-321-3268

**Chapel
Ridge**
FUNERAL HOME
& CREMATION CENTRE

416.993.0826
24/7 # 905.305.8508



તમારી સગવડ માટે અમે બે ફ્યુનરલ સેન્ટર ઓફર કરીએ છીએ. મારખમ અને મિસિસાગા. સંપૂર્ણ હિન્દુ તથા જૈન વિધિની સગવડતા. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

ફ્યુનરલ સર્વિસ, બેઝિક કાસ્કેટ, ક્રિમેશન અને ટેક્સ બધાં સાથે ટોટલ ફક્ત \$4270

વધુ માહિતી માટે ફોન કરો. અમારો પ્રોફેશનલ સ્ટાફ તમારી ભાષામાં તમને માહિતી આપશે.
પ્રિપેઇડ ફ્યુનરલ અને ટ્રાવેલ ઈન્સુરન્સ

1. તમારા ડોલર ફ્યુનરલ હોમમાં જમા નહિ થાય. પરંતુ સરકારે નીમેલી ટ્રસ્ટ કંપની પાસે રહેશે.
2. એક વખત પ્લાન ખરીદ્યા પછી તમે કે તમારા ફેમિલીએ કદીપણ વધુ પૈસા નહિ આપવા પડે.
3. ટ્રાવેલ ઈન્સુરન્સ - ફક્ત **\$595** એક વખત આપી જિંદગી ભર તમે ક્યાંય પણ નિશ્ચિત ટ્રાવેલ કરી શકશો. *

* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1
www.chapelridgefh.com • info@chapelridgefh.com